



સેવા રિપંડા

વર્ષ: ૨ • અંક - ૩ • ઓગસ્ટ ૨૦૧૯ • યુગાબ્દ ૫૧૨૧



વૃક્ષ છે અનમોલ રતન નિત્ય કરો તેનું જતન

સેવાભારતી ગુજરાત

સેવાભવન, ૭, જોલી પાર્ક સોસાયટી, શ્રેયસ કો. ઓ. સ્ટોરની બાજુમાં, કાંકરિયા, અમદાવાદ-૩૮૦૦૨૨ ગુજરાત

ફોર્માટ : ૦૭૯-૨૫૩૨૮૫૦૦ Email : sevavibhaggujarat@gmail.com



પृथिव्याम् त्रिणि रत्नानि जलमन्नं सुभाषितम् ।

मूढैः पाषाणखडेषु रत्नसंज्ञा विधीयते ।

आ पृथ्वी पर त्राण रत्नो छે. જળ, અમ અને સુભાષિત.

મૂર્ખ લોકો પથરના ટુકડાઓને જ રત્ન મને છે.

यત્તे भूमि विखनामी क्षिप्रं तदापि रोहतु ।

मा ते मर्म विमृगवरि मा ते हृदयमर्पिष्ठम् ॥

જળ આ ધરતી પર પ્રકૃતિની દેન છે, જે આપણને સ્વતઃ જ મળી જાય છે અને

સુખ આપે છે. આથી પરમાત્માનો આભાર માની તેની રક્ષા કરવી જોઈએ (અથવાદ)

संરक्ष्यार्थं च भूतानां सृष्टं प्रथमतो जलम् ।

यत्प्राणाः सर्वभूतानां वद्धन्ते येन च प्रजाः ॥

જીવોની સુરક્ષા કરવા માટે ઈશ્વરે સર્વ પ્રથમ જળનું સર્જન કર્યું.

કારણકે જળ જ બધાં ગ્રાણીઓનું જીવન છે. (નારદીય પુરાણ)

ઘૃતવત् પયः

જળ ધી ના સમાન છે. (અભ્યેદ)

આપો વા સર્વર્સ્ય જગત् પ્રતિષ્ઠા

જળ જ જગતની પ્રતિષ્ઠા છે. (શતપથ બ્રાહ્મણ)

કૂપવાપીતડાગાદિ....., ત્રિસમકુલમુદ્ધ્ય વિષ્ણુલોકે મહીયતે ।

કુલા, વાવ, તળાવ વગેરેના નિર્માણ કરવાથી ૨૧ કુળોનો ઉદ્ધાર થાય છે. (ગરુડપુરાણ)

दિવ्यા વृષ્ટિ અસ્માકં સુપારા ।

વરસાદ મળોલું જળ ઉત્તમ હોય છે, કારણકે તે દિવ્ય અને શુદ્ધ હોય છે. (અભ્યેદ)

મા આપો હિંસી ।

જળને પ્રદૂષિત ન કરો. (યજુર્વેદ)

જલે વાપિ યસ્ત્યજદહજં મલમ् ।

ભૂણહત્યાસમ પાપ સ પ્રાપ્નોત્યતિ દારુણ ।

જે વ્યક્તિ જળમાં વિષા, કફ અને મૂત્ર વિસર્જન કરે છે તેને ભૂણહત્યા સમાન

પાપ લાગે છે અને દારુણ નક્કને પામે છે. (નારદ પુરાણ)

પર્દાંસં મોષથા વૃક્ષં ।

જળના કિનારે વૃક્ષ ન કાપવં જોઈએ (અભ્યેદ)



સેવા સ્પંદન

વર્ષ : ૨ • અંક : ૩
ઓગસ્ટ-૨૦૧૬ • યુગાંદ્ર ૫૧૨૧

સંપાદક
શ્રી નરેન્દ્રભાઈ દવે
સંપાદક મંડળ
શ્રી નરેન્દ્રભાઈ દવે
શ્રી જનકભાઈ દવે
શ્રી ચિરીશભાઈ પટેલ

પત્રવ્યવહાર કાર્યાલય
સેવા ભારતી ગુજરાત
સેવાભવન, ૭, જોલી પાર્ક સોસાયટી,
શ્રેયસ કો. ઓ. સ્ટોરની બાજુમાં, કંકરીયા
અમદાવાદ-૩૮૦૦૨૨ ગુજરાત
દૂરભાષ : ૦૭૯-૨૪૩૨૮૫૦૦

Email : sevavibhaggujarat@gmail.com

મુદ્રક પ્રકાશક
સેવાભારતી ગુજરાત વતી
શ્રી ચિરીશભાઈ દિંમતલાલ પટેલ
નવભારત પ્રિન્ટિંગ પ્રેસ, ૮, પુનાજી ઈન્ડસ્ટ્રીયલ
એસ્ટેટ, શાન્દિલ્ય મંદિર પાસે, ધોબીઘાટ કોસ રોડ,
દૂર્ઘેશ્વર, અમદાવાદ-૩૮૦ ૦૦૪ ખાતે છપાવી
સેવાભવન, ૭, જોલી પાર્ક સોસાયટી,
શ્રેયસ કો. ઓ. સ્ટોરની બાજુમાં, કંકરીયા,
અમદાવાદ-૩૮૦૦૨૨ ગુજરાતથી પ્રગટ કર્યું.

અયં નિજ: પરોવેતિ ગણના લઘુ ચેતસામ् ।
ઉદાર ચરિતાનાંતુ, વસુધૈવ કુટુમ્બકમ् ॥
આ મારું છે કે બીજાનું આ પ્રકારની ગણના સાંકડા
મનવાળાઓની હોય છે. ઉદાર હદ્યવાળાઓ માટે તો
પૃથ્વી એ જ કુટુમ્બ છે.

- પંચતંત્ર

૫. પૂર્ણ બાળાસાહેબ દેવરસે કહ્યું છે કે -

અસ્પૃશ્યતા આપણા સમાજની વિષમતાનું અત્યંત
દુઃખાયી પાસું છે. કારણ ગમે તે હોય પણ આપણે સ્વીકારવું
જ જોઈએ, અસ્પૃશ્યતા એક ભયંકર ભૂલ છે. તે સંપૂર્ણ નાશ
પામવી જોઈએ, જો અસ્પૃશ્યતા પાપ નથી તો જગતમાં કશુંય
પાપ નથી.

અનુક્ષણિકા

| | |
|--|----|
| • સંપાદકીય | ૨ |
| • ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું ? | ૩ |
| • સંધનનું કાર્ય જ સામાજિક સમરસતા | ૪ |
| • માનવજીવન અને પર્યાવરણની એકબીજા પર અસર | ૫ |
| • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વૃક્ષારોપણ-માતર | ૬ |
| • ગરીબ દર્દીઓની સ્થિતિ જોઈ સેવા શરૂ કરી | ૭ |
| • વૃક્ષારોપણ વઠવાણી | ૮ |
| • ૮૪ વર્ષના વૃક્ષે સ્મરણાનને બનાવ્યું વૃક્ષોથી હર્યું-ભર્યું | ૯ |
| • ગ્રીન ગાર્ડ | ૧૦ |
| • સૂરજની ટકોર : પર્યાવરણ બચાવો | ૧૧ |
| • નગરને હરિયાણું બનાવવા વૃક્ષારોપણ | ૧૨ |
| • ગૌ સેવા એ જ રાષ્ટ્ર સેવા | ૧૩ |
| • રાષ્ટ્રીય સેવા ભારતી | ૧૪ |
| • સેવા શિક્ષણ પ્રમુખ કે કાર્ય | ૨૦ |

સંપાદકીય

આવો આપણો સૌ સાથે મળીને પર્યાવરણાની રક્ષા કાજે વૃક્ષારોપણને ગતિ આપીએ. વૃક્ષોએ વસુંધરાનો વૈભવ છે. રક્ષણ માટેનું કવચ છે અને ધરાનું સોહુમાણું આભૂષણ છે.

વર્ષા અને પર્યાવરણને શુદ્ધ કરતું સજીવ ઘટક છે બેબિલોન અને મેસેપોટેમિયાની સુધરેલી સંસ્કૃતિ યુધ્ય કે ભૂકુંપને કારણે નહિ પરંતુ વૃક્ષોનાં જંગલોના કમશાઃ વિનાશને કારણે જ લુમ થઈ હતી.

જે વ્યક્તિએ પોતાના જીવનકાળ દરમ્યાન એક્ય વૃક્ષ ઉછેર્યું ન હોય તેને લાકડા કે તેમાંથી બનતી ચીજ વાપરવાનો અધિકાર નથી. આપણો વૃક્ષોના ઋડણી છીએ. એક વૃક્ષ ૫૦ ટન જેટલું પાડું ઉત્સ્વેદન વડે વાતાવરણામાં ઉમેરે છે અને તાપમાનમાં ૧૦ થી ૧૨ ફેરનહિટ જેટલો ઘટાડો કરે છે.

જાહેર સંસ્થાઓને, સેવાકીય સંસ્થાઓને, સેવાભાવી નાગરિકોને સાથે જોડીને વૃક્ષારોપણ માટે પ્રેરણા આપીએ. અને તેમનો સહયોગ લઈએ. સ્કૂલના વિદ્યાર્થીઓનો પણ સહયોગ લઈએ.

રાજ્યના વન વિભાગ આપણને સહયોગ આપશે તો તેમનો સંપર્ક કરીએ.

વૃક્ષારોપણ કે ફક્ત કોઈ એક સમાઝ ઉજવવાનો કાર્યક્રમ નથી પરંતુ સમાજના નાગરિકમાં આ મારૂ કર્તવ્ય છે. તે ભાવ જગાવવા સતત પ્રયત્નશીલ રહીએ. વૃક્ષારોપણ કરતા પણ તેનું જતન, ઉછેરવા માટે સતત ધ્યાન આપે તેવી પ્રેરણા આપીએ.

સેવા કેન્દ્રોના લાભાર્થીઓને પણ સાથે જોડીએ.

આવો સૌ સાથે મળીને વૃક્ષો માનવી માટે કલ્યાણ વાંચછતા ઋષિયો છે તેમજ વૃક્ષો સાચા અર્થમાં મૌનધારી રચનાત્મક સર્જક છે, તેને સાકાર કરીએ.

નરેન્દ્રભાઈ દવે
(મુખ્ય સંપાદક)

ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું ?

સૌ કોઈ એ વાત સ્વીકારે છે કે માણસને તેના ગુણો અને તેની વર્તિશૂક દ્વારા માન-સંનાન મળે છે. સાચું બોલવું, પ્રમાણિક હોવું, પદ્ધતિસર કામ કરવું, નિયમોનું પાલન કરવું વગેરેનો પ્રાથમિક ગુણોમાં સામવેશ કરી શકાય. તેની સાથ અગત્યનો ગુણ છે ‘સમયપાલન’. જેને ટાઈમ મેનેજમેન્ટ પણ કહેવામાં આવે છે. આપણા દેશમાં દરેક સ્થળે મોંઢું પહોંચવાની એક કુટેવ ઘર કરી ગઈ છે, જેને લોકો કટાક્ષમાં ‘ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ’ પણ કહે છે.

‘સમયની કદર ન કરનારની કદર સમય પણ કરતો નથી.’ આવું વીલો દ્વારા અવારનવાર કહેવામાં આવે છે. લંચ-બ્રેક લીધા પછી વર્ષાંડમાં મોડા આવતા અંકુરને મેં પૂછ્યું, ‘કેમ મોંઢું થયું?’ તો તેણે કહ્યું, ‘ફકત પાંચ મિનિટ મોંઢું થયું છે, સાહેબ, જવા દો ને’ જરા પણ ગંભીરતા વિનાના અંકુરને ફલાઈટ ઉપડવાની પાંચ મિનિટ પછી મોકલીએ તો ખબર પડે.

મેં કહ્યું, ‘વાંધો નહિ. પરીક્ષામાં તને હું પાંચ મિનિટ પેપર મોંઢું આપીશ. ચાલશે?’ તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને કહ્યું, ‘સાહેબ, મારે કોઈ જગ્યાએ મોડા જવાની ઈચ્છા નથી, પણ હું સમયસર પહોંચેલી શકતો જ નથી. શું કરવું એ નથી સમજાતું’ આ પ્રશ્ન માત્ર અંકુરનો જ નહીં, પરંતુ દરેક વ્યક્તિનો બની ગયો છે, જેમાં તમે પણ બાકાત નથી.

સમય જ માત્ર એવો છે કે જેને ઈશ્વરે અમીર કે ગરીબ, ભાગેલા કે અભાગ બધાને માટે સરખો જ આપ્યો છે. બચત માત્ર પૈસાની જ નહીં પરંતુ સમયની પણ જ શકાય. પોતાને મળેલા સમયનો સદૃષ્યોગો કરવા આયોજનપૂર્વક સમયનું મેનેજમેન્ટ કરવું આવશ્યક છે.

આ સાથે જ પલક બોલી, ‘સાહેબ, દસ-પંદર મિનિટ થોંડું વધુ સમજાયો ને’ મેં કહ્યું, ‘દસ અને પંદર મિનિટમાં પાંચ મિનિટનો ફર્ડ છે. પાંચ મિનિટની કિંમત જ્યારે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિની અપોઈન્ટમેન્ટ લેવા માટે પૂછો ત્યારે ખબર પડે છે.’ જો આપણે સમયની નાની-નાની બચત નહીં કરીએ તો એક હિવસે પસ્તાવાનો સમય આવશે. તમે નહીં જાણતા હો કે ચાર્લી ચેપિલન જેવી દુસ્તીને પણ ગાંધીજી સાથે વાત કરવા માટે દાદરા વીતરતાં સમયે માત્ર એક મિનિટ મળી હતી. સમયપાલનની ટેવ નાની ઉમરથી જ પાડવી જોઈએ. આગ લાગે ત્યારે કૂવો ખોદવાથી કોઈ જ ફાયદો થવાનો નથી. જ્યારે આપણે કોઈ ફિલ્મ-કલાકારોનો એક મિનિટ સમયનો ભાવ લાખો રૂપિયામાં સાંભળીએ છીએ ત્યારે આશ્રય થાય છે. પરંતુ આવા લોકો પોતાની એક-એક મિનિટનો સદૃષ્યોગ કરે છે અને

સમયને તેઓ Time is Money કહી રૂપિયા સાથે સરખાવે છે.

અંકુરે પૂછ્યું, ‘સાહેબ, અમે કઈ રીતે ટાઈમ મેનેજ કરી શકીએ?’

મેં કહ્યું, ‘રોજનું એક ટાઈમટેબલ બનાવવું જોઈએ. કયા સમયે કયું કાર્ય કરવું તેનું આયોજન કરવું. રોજ કરવાનાં કાર્યો અને તેના માટે લાગતો સમય. જો આવું વિભાજન કરીશ તો સમજાશે કે તારી પાસે સમય જ સમય છે’

તમે પણ સમય બચાવવા માંગો છો? તો તમારાં રોજબનોજનાં કાર્યોમાં ફેરફાર કરો. થોંડું ઝડપથી ચાલો. નાહિવા અને તૈયાર થવામાં થોડી ઝડપ રાખો. સોશયલ મીડિયા ડિવસમાં બે જ વખત જ જુઓ. એક સમયે એક જ કામ કરો. મોબાઇલમાં રહેલ દરેક પ્રકારની ગેમને દૂર કરો.

આ મુજબની કિયાઓને અમલમાં મૂક્તાં તમે સમયના ફર્ડને અનુભવી શકશો. ટાઈમ મેનેજમેન્ટને લાઈફ મેનેજમેન્ટનું પ્રથમ પગથિયું બનાવો. ટાઈમટેબલ બનાવવાથી તમે દરેક કાર્ય સમયસયર અચૂક કરી શકશો. સમયનું આયોજન કરતાં પહેલાં દરેક પ્રવૃત્તિ સમયસર જ કરવી છે એવો એક સંકલ્પ કરો. તમારી પ્રવૃત્તિનું એક ટાઈમટેબલ બનાવો. તમારાં કામોને – જરૂરી, અદ્યતા જરૂરી અને સૌથી વધુ જરૂરી એવા વિભાગોમાં વહેંચો. સમય પહેલાં કામ પૂરું થાય તો ‘વરી ગુડ’, સમયસર કામ પૂરું થાય તો ‘ગુડ’ અને સમય કરતાં મોંઢું થાય તો ‘બેડ’ આ પ્રકારના ગેડ આપો.

બેસ્ટ ટાઈમ મેનેજમેન્ટ શીખવું હોય તો તમારાં માતા કે વીલો પાસથી શીખો. પ્લાનિંગ અને મેનેજમેન્ટમાં ભારતની દરેક ગૃહિણીને આદર્શ માનવામાં આવે છે. ડિગ્રીઓ વધુ હશે, પરંતુ જો ટાઈમ મેનેજમેન્ટ નહીં હોય તો ભવિષ્ય અંધકારમય બની જશે. ‘ટાઈમ એન્ડ ટાઈડ વેઈટ ફોર નન.’ આપણે પણ આ વાત જેટલી વહેલી સમજશું તેટલું જ ભવિષ્ય માટે સારું થશે. તો ચાલો, ‘કલ કરે સો આજ, આજ કરે સો અબ, પલમેં પરલય હોએગા, બહુરી કરેગા કબ.’

સમય કંડી હવા જેવો છે. તેને પકડી શકતો નથી, પરંતુ યોગ્ય જગ્યાની પસંદગી દ્વારા તેને અનુભવી ચોક્કસ શકાય છે. સમય વહેઠી નથી જેવો છે, જેને રોકી શકતો નથી, પરંતુ આયોજનનો બંધ બાંધીને તેની શક્તિનો મહત્તમ ઉપયોગ કરી શકાય છે.

– ડૉ. આશિષ શુક્લા
તેમના પુસ્તક – યુવા પ્રશ્નોનું #HANGOUT માંથી

સંઘનું કાર્ય જ સામાજિક સમરસતા

(પ.પૂ. સરસંઘચાલક મા. મોહનજીનું માર્ગદર્શન)

રા.સ્વ.સંઘનું કાર્ય જ સામાજિક સમરસતા છે. સન ૧૮૫૭ પછી પણ અનેક સંગઠનો અને મહાપુરુષોએ આ દિશામાં ખૂબ જ પ્રભાવી કાર્ય કર્યું છે. સંઘમાં પણ સન ૧૮૮૫ ની વિજયાદશમીથી જ આ કાર્યનો શુભારંભ થયો છે. આપણે હિંદુ સમાજમાં સમરસતા નિર્માર્ણ થાય એ માટે અનેક પ્રયોગો કર્યા છે અને એટલો બુહોળો અનુભવ આપણી પાસે છે, તેને આગળ વધારવાનું કામ આપણે કરવાનું છે. આમ તો સંઘની શાખા જ સમરસતાનું શ્રેષ્ઠ સાધન છે. આપણા સમાજ પર અનેક દિશામાંથી અનેક પ્રકારે આકમણ થઈ રહ્યા છે. ભેદભાવ અને ઉપેક્ષાના શિકાર બનેલા લોકોને આ સમાજથી તોડીને, મૂળમાંથી કાપીને રાણ્યવિરોધી ખદયનોના ભાગરૂપે ઊભા કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. આપણા પ્રયત્નો વધવાથી તેમાં ઘટાડો નિશ્ચિત છે. પરંતુ એ ન હોતો પણ આપણે જ પ્રયત્નો કરી રહ્યા છીએ એ જરૂરી છે.

એ વાત સ્પષ્ટ સમજ લઈએ કે સમરસતાનું કાર્ય એ પ્રચારનું કાર્ય નથી. આ કાર્યમાં મોટા મોટા ભાષણ આપવાની જરૂર નથી. ઉત્તમ પ્રવચનનું પણ અહી મહત્વ નથી. નેતાગીરીનું કામ નથી. આ કરવાનું પણ કામ નથી, ઉપકારનું પણ કામ નથી, પુણ્યનું પણ આમાં કામ નથી, ધર્મનું કામ પણ નથી, એવી કોઈજ ભૂમિકા આમાં નથી. આપણે કહીએ છીએ કે આ પરિમાર્જન છે. માત્ર આપણું કર્તવ્ય હોવાથી આ કામ કરીએ છીએ એવું શુષ્ક કામ પણ આ નથી. માત્ર રાજનીતિનું પણ કામ નથી આ કામ ભાવનાનું કામ છે, મનને બદલવાનું છે.... સમાજનું માનસ પરિવર્તન કરવાનું છે. દરેક સમાજે સમયને અનુરૂપ બદલવું પે છે. મનમાં અનેક અપરાધ બોધ

લઈને જવાની જરૂર નથી. તમે ખરાબ કરી રહ્યા છો અને અમે સુધાર કરી રહ્યા છીએ એવી ભાવના લઈને પણ સમાજમાં જવાની જરૂર નથી. મનમાં શુષ્ક ભાવના લઈને જરૂર જોઈએ. આપણા જ ભાઈઓ છે. એકબીજા બંધુઓને આપણે જોડવાના છે, નહી જોડવાથી સમાજનું નુકસાન છે. નુકસાનને કારણે જ જોડવા એ પણ આપણનું કામ નથી. આપણનું મન આટલું સ્પષ્ટ અને નિર્મળ બનાવવું છે. જે ભાઈઓ દૂર થયા છે એમનામાં પરિવર્તન લાવવાનું છે. ગુરુજીનું વાક્ય છે: ‘વિષમતા સવાર્ણ લોકોના મનનો રોગ છે.’ આ વિષમતા મનમાં રહેલી છે. અને મનમાંથી હટાવવી પડશે... એને હટાવવી એટલે જ સમરસતા. આથી બધાજ પ્રકારની ચીલાચાલુ પદ્ધતિઓ, આકર્ષણો, રાજનીતિ અને પ્રચાર-પ્રસારથી દૂર રહીને આ કામ કરવાનું છે. જેનો એટલો ઉપયોગ છે એટલો કરવો જોઈએ, પરંતુ જેનું કામ નથી એમાં પડવાની જરૂર નથી. કાર્યને અનુરૂપ આપણે આપણી જાતને ઢાળવી પડશે. આ કામ કરવાના ત્રણ આયામ છે. (૧) બૌદ્ધિક જગત (૨) આચરણમાં મુકવાનું (૩) વિવિધ પ્રવૃત્તિના કાર્યક્રમ - ઉપકમ.. માત્ર ચિંતનથી કામ ચાલશે નહીં. બૌદ્ધિક પક્ષ અને પછી આવે છે પ્રવૃત્તિની બાબત, એ પહેલા આચરણ-વ્યવહારનું પણ સું આવે છે. એનાથી જ બાકીના બેનું સંતુલન રહે છે. આ વિશે ચિંતન તો ધંણું થયું છે, પહેલાં પણ થયું છે. આ ચિંતન આચરણમાં આવ્યું નથી એટલે જ કાર્યમાં શ્રુતા નથી. કાર્યમાં શ્રુતા જોડવી જોઈએ. આપણે કહીએ છીએ એ સત્ય છે, પરંતુ એ પ્રત્યે લોકોને વિશ્વાસ નથી. વિશ્વાસ કેમ નથી? આપણા આચરણના અનુભવ જ્યાં પહોંચવા જોઈએ ત્યાં પહોંચ્યા નથી. આથી સૌ પ્રથમ બૌદ્ધિક અને વિવિધ કાર્યક્રમના

સંતુલન માટે આચરણ અનુભવનું પાસું નિર્માણ થવું જોઈએ. આ વ્યવહાર મનથી થવો જોઈએ. આપણે આંતરજ્ઞાતિ લગ્ન, સમૂહ બોજન જેવા કાર્યક્રમ થાંથી આપ્યા છે, આપીએ છીએ, આપીશું, મનથી આ કામ થવું જોઈએ. કોઈને પ્રશ્ન પૂછ્યો કે, ‘મંદિર તૂટવાથી હદયને આધાત લાગે છે, એવી રીતે દલિતો પર હુમલો થાય ત્યારે આધાત લાગે છે?’ આ સ્વભાવ બનવો જોઈએ. સ્વભાવ મનથી બને છે બુદ્ધિથી નહીં. બુદ્ધિથી તો બધા જ સ્વયંસેવકોને આ વિચારની ખભર છે અને બુદ્ધિથી બધા જ સ્વયંસેવકોને કોઈપણ જાતની પૂર્વશરત વિના એ મંજુર છે. આપણા વિચાર-પરિવારના સંપર્કમાં આવનાર કોઈપણ વ્યક્તિ આ વિચારના વિરોધમાં નથી. મુખ્ય વાત બધાને માન્ય છે. પરંતુ બે હજાર વર્ષથી જે આદતો છે એને બદલવાનો મૂળ પ્રશ્ન છે. જેમ કોઈ ઘરમાં વિવિધ તસવીરો ટીવ્ઝિયલ હોય એમાં ડૉ. આંબેડકરની તસવીર જોઈ બધા પ્રશ્નો આપોઆપ મટી જાય છે. કારણે એના પ્રત્યે શ્રુતા અને વિશ્વાસ છદ બની ગયા છે. હવે સવાલ પૂછવા માટે કોઈ કારણ નથી. આ વાતને પ્રત્યક્ષ વ્યવહારમાં મુકવી પડશે શરૂઆત પોતાનાથી જ કરવી પડશે. સૌ પ્રથમ હું અને મારો પરિવાર, એ પછી મારા સાથીઓ અને મારું સંગઠન અને પછી સમાજ... એક જગ્યાએ પૂર્ણ થાય પછી બીજી જગ્યાએ શરૂ થાય એવી રીતે નહીં, પરંતુ ત્રણેયનું ધ્યાન રાખવું પડશે. સમાજને સમરસ બનાવતી વાતે આપણા પોતાના મનને અને ઘરના વાતાવરણને ધ્યાનમાં રાખવું જોઈએ. ભાગ એની મેળેજ કાબુમાં આવી જશે, હું જે કંઈ કહું છું, એ કરવાનું ભાગ રહેશે, પોતાના પરિવારમાં પણ સમરસતાનું વાતાવરણ બનવા લાગશે.

માનવજીવન અને પર્યાવરણની એકબીજા પર અસર

કુદરતમાં પર્યાવરણ અને માનવજીવન વચ્ચે સહીઓથી નિકટતમ સંબંધ રહેલો છે. માનવજીવનના વિકાસ સાથે પર્યાવરણીય સમૃદ્ધિલાંબાં પરિવર્તન થયું છે.

પર્યાવરણ માનવ માટે પોખક, રક્ષક અને આશ્રયદાતા છે. તેથી તેની જગતાની કરવી જોઈએ. તેને બદલે દિન-પ્રતિદિન પર્યાવરણ વધુને વધુ પ્રદૂષિત થતું રહ્યું છે. એ માટે જવાબદાર છે સ્વાર્થી માનવી. પ્રદૂષિત પર્યાવરણ માનવજીવન અને પ્રાણીસૂચિના આરોગ્ય ઉપર અસર કરે છે.

માનવીએ સ્વાર્થ માટે પર્યાવરણની જગતાની બાબતે ઉપેક્ષા જ સેવી છે. વનસ્પતિ અને પ્રાણીઓ માટે ખાસ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન જરૂરી છે. વસ્તીવધારો, ઔદ્યોગિકરણ, વૃક્ષછેદન, વાહનન્યવહાર તથા વિવિધ બળતણને કરણે વાતાવરણમાં CO_2 નું પ્રમાણ વધ્યું છે. CO_2 પ્રમાણ છેલ્લાં થોડાં વર્ષમાં ૨.૫ ટકા જેટલું વધ્યું છે. તેનાથી પૃથ્વીના સરેરાશ તાપમાનમાં ૦.૬૦ સેલ્વિસ્યસનો વધારો થયો છે. ઉધ્મા શોખી લેતા CO_2 ભિયેન, ઓઝોન (O_3) વગેરે વાયુઓથી તથા તાપમાનના વધારાને ગ્રીનહાઉઝ ઈફ્કટથી સંતુલિત કરે છે. જો આ વધારો ચાલુ રહે તો બીજાં ૫૦ વર્ષમાં પૃથ્વીનું તાપમાન ૧.૫૦ સેલ્વિસ્યમથી ૪.૫૦ સેલ્વિસ્યસ વધવા સંભવ છે. આનાથી સમુદ્રની સપાટી ઊંચી આવશે અને દરિયાકાંદાળા વિસ્તાર અને ટાપુઓના ભાગ દૂબી જશે તથા મોસમમાં આણધાર્યો ફેરફાર થશે.

ખનિજ કોલસો, પેટ્રોલિયમ વગેરે બળતણો બળવાથી CO_2 , CO ઉપરાંત સલ્ફર ડાયોક્સાઇડ, નાઈટ્રોજનના વિવિધ

ઓક્સાઇડો તથા કાર્બનના રજકણો વગેરે વાતાવરણમાં મુક્ત થાય છે. બળતણના દફન દરમિયાન કેટલાક વિશિષ્ટ પદાર્થો જેવા કે હાઈડ્રોકાર્બન, સીસાના રજકણો વગેરે ઉત્પત્ત થાય છે. ઔદ્યોગિકરણના વિકાસના કારણો આવા જેરી વાયુઓનું પ્રમાણ વધવા માંડયું છે. CO_2 નું પ્રમાણ વધવાથી વાતાવરણનું તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે. તેના વધુ પ્રમાણથી આપણને બેચેની લાગે છે. CO જેરી વાયુ છે, તે લોહીમાંના હિમોગ્લોબીન સાથે ભળી કાર્બોક્સી હિમોગ્લોબીન બનાવે છે. શરીરમાં રહેલા હિમોગ્લોબીનના જથ્થાને અસર કરે છે. ‘નેશનલ એકેડ્મી ઓફ સાયન્સ’ના સંશોધન અનુસાર CO ના પ્રમાણથી હંદયરોગના હુમલાની શક્યતા રહે છે. CO ના વધુ પડતા પ્રમાણથી માથાનો દુઃખાવો, ઊલટી, ચક્કર આવવાં, ગુંગળામણ અનુભવવી વગેરે જોવા મળે છે. નાઈટ્રોજન ઓક્સાઇડ આંખમાં દાઢની અસર ઉત્પત્ત કરે છે તથા ઓઝોન વાયુનો નાશ કરે છે. ઓઝોન વાયુ સૂર્યપ્રકાશમાં રહેલાં પારજાંબલી કિરણોને પૃથ્વી પર આવતાં રેઝ છે. પારજાંબલી કિરણો આપણા માટે નુકસાનકારક છે. SO_2 , CO_2 તથા નાઈટ્રોજન, ઓક્સાઇડો બેજની હાજરીમાં ઘાતુઓનું ક્ષરણ કરે છે. તેથી ઘાતુઓ અને તેનાં પાત્રો નિસ્તેજ બને છે. એસિડિક વાયુની હાજરીમાં ઈમારતો, સ્થાપત્ય, ચિત્રો વગેરેને તેનાથી નુકસાન થવાની શક્યતા વધે છે.

વાતાવરણમાં ધૂળના રજકણો, કાર્બનના રજકણો, પાણીની વરણ વગેરેના મિશ્રણથી ધૂમ્રમસ ઉત્પત્ત થાય છે. જે

આપણી દિણ્ગોચરતા ઓછી કરે છે. ધૂળના રજકણો, હાઈડ્રોકાર્બન વગેરેથી મનુષ્યો અને પ્રાણીઓમાં શાસોચ્છવાસની તકલીફ ઉભી થાય છે તથા ફેફસાંનો રોગ થાય છે. જંતુનાશકોના વધારે પડતા ઉપયોગને કારણે પણ વાતાવરણમાં જેરી દ્રવ્ય ઉમેરાય છે.

રેડિયો-એક્ટિવ વિકિરણ જ્ઞાન અને રંગસૂત્રો (Chromosomes)ને નુકસાન પહોંચાડે છે, જેની અસર ભાવિ પેઢી પર પણ પડતી હોય છે. ૬૦૦ રોન્ટઙન જેટલો વિકિરણનો જથ્થો માનવીના સમગ્ર શરીર પર આપાત થાય તો તેનું મૂત્યુ થઈ શકે છે. ૧૦૦ રોન્ટઙન જેટલા વિકિરણથી લ્યુકેમિયા કે અન્ય કેન્સર થવાની સંભાવના રહેલી છે. અત્યાર સુધીમાં વિશ્વમાં થયેલા ન્યુકિલયર રિએક્ટર અક્સમાતોમાં બે અક્સમાતો મુખ્ય છે. આમાં એક અમેરિકાના શિમાઈલ આઈલેન્ડ ખાતેનો, બીજો રશિયાના ચારનીબલ ખાતેનો ન્યુકિલયર રિએક્ટર અક્સમાત છે. આ અક્સમાતોમાં ઉત્સાહીયિલ પ્રચંડ રેડિયો-એક્ટિવ વિકિરણને લીધે સેંકડો લોકોની જાનહાનિ થવાનું જાણવા મળ્યું છે.

પર્યાવરણ એટલી હુદે પ્રદૂષિત બની ગયું છે કે ચોમાસામાં ‘એસિડ વરસાદ’ વરસે છે, જે વનસ્પતિ અને વૃક્ષોને નુકસાન કરે છે. ઇ.સ. ૧૯૮૧માં થયેલા ખાડીયુદ્ધ દ્વારા ખનિજ તેલના કૂવાની આગને પરિણામે બરફાચાઈત વિસ્તારોમાં ‘કાળો બરફ’ વરસ્યો હતો હાલમા ચેચેનિયાના ખનિજ તેલના કૂવામાં લાગેલી આગને પરિણામે રશિયા તેમજ ભારતના પર્યાવરણ ઉપર વિપરીત અસર થવાનો પૂરો સંભવ છે. એ મતલબની ચિંતા સાહિત્યકાર, પત્રકાર,

કવિશ્રી ભગવતીકુમાર શર્માએ ગાંધીસ્મૃતિ ભવનમાં ‘કાળશિલ્પ’ (મંગળ રાડોડ)ના કાવ્યસંગ્રહના મંગલ પ્રકાશન વિધિ સમયે કરી હતી

પર્યાવરણમાં વિક્ષોભને લીધે ઉત્પન્ન થતા અતિતીવ્ર બિનજરૂરી ધ્વનિને ‘ધોંઘાટ’ કહે છે. ધોંઘાટને લીધે માનવીના મગજ પર તથા શારીરિક તંદુરસ્તી પર પ્રતિકુળ અસર પેં છે. ધોંઘાટને લીધે લોહીનું ઊંચું દબાણ કે હદયની તકલીફો પણ થઈ શકે છે. ધોંઘાટને લીધે માથાનો દુઃખાવો, આણગમો અને વિધિત્ર માનસિક વર્તન જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. ધોંઘાટથી રક્તપ્રવાહમાં એન્ઝોનિલનો સાવ વધે છે. અને તેથી ગભરાટ, ચિંતા, સનાયુઓના ભેંચાણમાં

વધારો થાય છે, જેથી આંખની જોવાની શક્તિ રૂપ ટકા ઘટી જાય છે. રંગ ઓળખવાની શક્તિ પણ ઓછી થાય છે અને રતાંધળાપણું આવે છે.

ઔદ્યોગિક વિકાસ તથા ખનિજ તેલના વધુ પડતા ઉપયોગથી હવા, પાણી અને અવાજનાં પ્રદૂષણો વધતાં જશે. આ બધાંને કારણે તથા જંગલોમાં પ્રાણીઓના થતા શિકારને કારણે કેટલાક સજીવો પૃથ્વી પરથી લુપ્ત થવાની અણી પર છે. યુદ્ધમાં વપરાતા ‘રાસાયણિક બોમ્બ’ તથા ‘જૈવિક બોમ્બ’ એ માનવજીવનને યાતનાભર્યું અને પીડાદાયક બનાત્યું છે. અવકાશ સંશોધનને લીધે અવકાશીય પ્રદૂષણ પણ વધી રહ્યું છે. અવકાશમાં તરતા મુકાતા ઉપગ્રહોને લીધે ‘ચુંબકીય પ્રદૂષણ’ ઉત્પન્ન થયાના સમાચાર

વર્તમાનપત્રોમાં પ્રગટ થયા હતા. સાથે સાથે આપણાં સામાજિક અને માનસિક પ્રદૂષણ ભાવ પેઢીને અસથ નુકસાન જરૂર પહોંચાડશે.

પ્રકૃતિ માનવ માટે ઝૂર નથી, પરંતુ માનવી જ પ્રકૃતિ સાથે ઝૂરતા અપનાવી રહ્યો છે. માનવજીવન અને પર્યાવરણની સમતુલા જાળવી તે સંસ્કૃત માનવનું કરત્વ છે. જો પર્યાવરણના સંરક્ષણ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવશે તો ઉત્કાંતિની ટોચ પર બેઠલો માનવી પોતાના દ્વારા જ અધોગતિની ઊરી ગત્તમાં ધકેલાઈ જશે એમાં જરાય શંકા નથી.

- રમેશ પટેલ
તેમના પુસ્તક - પર્યાવરણ અને માનવજીવન મંથી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વૃક્ષરોપણ-માતર



રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોલેજુયન શાખા અને સંયુક્ત વિદ્યાર્થી શાખા દ્વારા ગામમાં વૃક્ષરોપણનો કાર્યક્રમ થયો. જેમાં ગામના મંદિરો, સરકારી હોસ્પિટલ, બસ સ્ટેન્ડ, પોલીસ સ્ટેશન, સંઘ સ્થાન તેમજ અન્ય જગ્યાઓ ઉપર વૃક્ષો ઉછેર કાર્યક્રમ કર્યો. જેમાં ૨૦ બાળ અને ૧૩ તર્ફાણ દ્વારા કાર્યક્રમ ખૂબ સરસ થયો.

સગાંની ખબર કાઢવા ગયા અને ગરીબ દર્દીઓની સ્થિતિ જોઈ સેવા શરૂ કરી
સિનિટર સિટિજન છ વર્ષથી સોલા સિવિલમાં રોજના
૧૦૦ કિલો કેળાનું દાન કરે છે, મુસ્લિમ વેપારી ૪૦ કિલો કેળા મફત આપે છે

ધર્મિકા પટેલ • અમદાવાદ

એક વૃદ્ધ જનસેવા માટે અર્ધ સરકારી નોકરીમાંથી નિવૃત્તિ લીધી અને સેવાયજ્ઞમાં બીજા સાત સિનિયર સિટીજન જોડાયા. આજે આ ચુપ સોલા સિવિલ હોસ્પિટલના તમામ દર્દીને તથા સ્વિપરને ઉદ્ઘાટન દિવસ કેળાનું દાન કરે છે. તેમનો ટાર્ગેટ શહેરની સરકારી હોસ્પિટલને આ દાન આપવાનો છે. સાયન્સ સિટીમાં રહેતા દર્દીની વર્ષીય પિનાકિન દેસાઈ અને તેમના ભિંતો એક પણ દિવસ ચૂક્યા વગર છેલ્લા છ વર્ષથી સોલા સિવિલમાં રોજ સવારે ૧૦૦ કિલો કેળા વહેંચે છે. પિનાકિનભાઈએ જાણપાંચ હતું કે, થોડાક વર્ષો પહેલા મારા ફોર્ઝિને સોલા સિવિલમાં દાખલ કર્યા હતાં. હતું-પત્ની સાથે તેમની ખબર પૂછવા ગયો ત્યારે મેં જોયું કે ત્યાં દર્દી પાસે કેસ કટાવવાના પ રૂપિયાના પણ ફાંફાં હોય છે. ત્યારે એમ થયું આ લોકોને ફળો ખાવા કેવી રીતે પોસાય? એ દિવસે આ જ હોસ્પિટલમાં એમડી ડૉક્ટર તરીકે ફરજ બજાવતી મોટી દીકરીની સાથે વાત કરી તેમને હતું શું મદદ કરી શકું એમ પૂછ્યું? મારી દીકરીએ કદ્યું પપ્પા તમે આમને બિસ્કિટનું એક પેકેટ પણ આપશો તો તેમના ચહેરા પર ખુશીની લહેર જોવા મળશે. મેં પહેલા ૨૦ કિલો કેળા આપવાથી શરૂઆત કરી. છ મહિનામાં ૬૦ કિલો કેળાં વહેંચવાનું શરૂ કર્યું ત્યારે ખમાસા જનતા કેળાવાળાના તાંધી ખરીદતો હતો. તેના માલિક ઈંદ્રાહિમભાઈને હતું કેળા હોસ્પિટલના

દર્દીની આપવા માટે લઈ જાઉં છું તેવો ખ્યાલ આવતા તેમણે ખૂટતા બે કેરેટ એટલે કે ૪૦ કિલો કેળાં મફત આપવાનું શરૂ કર્યું. આજે હું ત્યાંથી ૧૦૦ કિલો કેળાં ખરીદું અને પૈસા ૬૦ કિલોના ચૂક્યું છું. આ સેવા વિશે સાંજે ઔડા ગાર્ડનમાં ભેગા થતા સિનિયર સિટીજનો સાથે સાહજિક વાર્તાલાપ થયો. જેથી તેઓ પણ આ સેવામાં જોડાઈ ગયા અને સવારે તેઓ મારી સાથે હોસ્પિટલ પરિસરમાં કેળા વહેંચવામાં મદદ કરે છે.

સેવા માટે વહેલી ‘નવૃત્તિ લીધી

પિનાકિનભાઈએ સેવા માટે વહેલી નિવૃત્તિ લીધી હતી. જો દર્દી ઓછા હોય તો તેઓ હોસ્પિટલના ગેટ પાસે ત્યાંથી પસાર થતાં બાળકો, ઓપીડીની લાઈનમાં ઊભા રહેલા દર્દીના બાળકોને કેળાં વહેંચે છે.

ઉમદા કારણથી પ્રેરણા મળી

મેં ફૂટપાથથી ફૂટ વેચવાનું કામ શરૂ કર્યું હતું. આજે હું હોલ્સેલનો વેપારી છું. પિનાકિનભાઈ દાન કરવા મારી પાસેથી કેળા ખરીદતા હતા તેથી મને મન થયું એટલે હું તેમને ૪૦ કિલો મારા તરફથી આપું છું.

- ઈલાહિમ શેખ, કેળાનાં વેપારી

કુષ (રક્તપિતા)ની સેવા કરો

કુષ રોગથી પીડીતોને બેટૂલપૂર, (મ.પ્ર.)ની મીશનરી હોસ્પિટલમાં કહેવામાં આવ્યું ‘રામ-કુષણ કોઈ તમને બચાવી નહીં શકે, અમે ફક્ત દવા આપીએ છીએ પરંતુ તમને લાચારીથી બચાવીને સારા કરશે માત્ર ઈશા મસીહ એટલા માટે ઈશુની શરાણમાં જાઓ.’ આ સાંભળીને સદાશિવ ગોવિન્દ કાત્રેને અસર્ય પીડા થઈ. મનમાં વિચાર આવ્યો કે, સમાજમાં ફેલાયેલ કુષરોગ સંબંધી ખોટી ધારણાઓને લીધો કુષ રોગીઓ પ્રત્યે ભય અને ધૂણાનું વાતાવરણ બને છે અને પોતાના સ્વજનો પણ તેમનાથી દૂર ભાગે છે. રોગીને ધીરજ આપીને યોગ્ય ઉપયાર કરો તો રોગી સારો થઈ જાય છે. પરંતુ કેવા છે આ લોકો, જે

મનુષ્યની મજબુરીનો લાભ લઈને તેને ધર્માત્મારિત કરે છે? હું એક એવો આશ્રમ બનાવીશ, જ્યાં માત્ર કુષ સેવા જ થશે. ધર્માત્મારણ નહીં. આવો સંકલ્પ લઈને તે પ્રૌઢ સ્વયંસેવક પ.પૂ. ગુરુજી પાસે પહોંચયા. શ્રી ગુરુજ્ઞાન પવિત્ર આશીર્વાદ અને પોતાની ભવિષ્યનિધિ અને પેન્શનના પૈસાથી આ ભૂતપૂર્વ રેલ્વે કર્મચારીએ મધ્યપ્રેદેશના ચાંપા જેવા સ્થાન ઉપર ‘રામકુષણ કુષ સેવાશ્રમ’ની સ્થાપના કરી. ઘેર ઘેરથી મુહૂર્ત મુહૂર્ત ચોખા અને દાનના પાંચ-દસ પૈસા ભેગા કરતાં કરતાં તેમણે પોતાનું પૂર્ણ જીવન આ કાર્યમાં ખાપાવી દીધું. પોતાને ક્ષણ ક્ષણ ગાળીને અનેક લોકોને એમણે કુષ રોગથી ગળતા બચાવ્યા.

પર્યાવરણ બચાવવા વઠવાણ પંથકમાં ૮૫ હજાર છોડ વાવી ઉછેર કરવામાં આવશે

૫૦૦ વિદ્યાર્થીનો સંકલ્પ, ૫ હજાર છોડ વાવું

ભાસ્કર ન્યૂઝ ● વઠવાણ

સુરેન્દ્રનગર જિલ્લાને હરિયાળો બનાવવા માટે વઠવાણ તાલુકામાં ૮૫ હજાર વૃક્ષોનું વાવેતર થનાર છે. જેના ભાગરૂપે શાળાના બાળકીને વઠવાણ નર્સરી ખાતે એક હજાર વૃક્ષોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે પાંચ હજાર વૃક્ષોનાં વાવેતરનો વિદ્યાર્થીનો ગ્રીનટેસ પહેરીને સંકલ્પ કર્યો હતો.

જાલાવાડમાં વૃક્ષોની સંખ્યા સમગ્ર રાજ્ય કરતા ઓછી છે. આથી ગુજરાતના સૌથી ઓછા વૃક્ષનું કંલક સુરેન્દ્રનગર જિલ્લાને લાગ્યું છે. ત્યારે ગ્રીન જાલાવાડ અને હરિયાળો સુરેન્દ્રનગર જિલ્લો અભિયાન હુથ ધરાયું છે. જેમાં વઠવાણ પંથકમાં ૮૫ હજાર વૃક્ષોના વાવેતરનું આયોજન કરાયું છે. આથી વઠવાણ બોડા તળાવ ખાતે નર્સરીમાં એક લાખ જેટલા વૃક્ષોનું વિતરણ વિના મૂલ્ય કરવાનું આયોજન ફોરેસ્ટ વિભાગ દ્વારા હુથ ધરાયું છે. ત્યારે વઠવાણ શહેરની ૫૦૦ વિદ્યાર્થીનો લીલા કપડા પહેરીને નર્સરીમાં પહોંચ્યો હતી. જેમાં અમ. યુ. શેઠ ગલ્સ હાઇસ્કૂલના શ્રી ભરતસિંહ ચાવડા, શ્રી નન્દભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ

વિદ્યાર્થીનો ગ્રીનજાલાવાડ, ગ્રીનટેસ સ્ક્રો પોકાર્યા હતા. ત્યારબાદ વઠવાણ નર્સરી ખાતે વૃક્ષોનું મહત્વ, વૃક્ષારોપણ, વિવિધ વૃક્ષોની જાતોની માહિતી અપાઈ હતી. ત્યારબાદ વઠવાણ તાલુકાના આરએફઓ શ્રી વી. એમ. રાણાએ તમામ વિદ્યાર્થીનોને વૃક્ષોનું વિતરણ કર્યું હતું. આથી વઠવાણની ગલીઓ, શેરીઓ અને ઘરમાં વૃક્ષારોપણનો સંકલ્પ કર્યો હતો. વઠવાણ શહેરની તમામ શાળા, હાઇસ્કૂલો, સોસાયટીમાં વૃક્ષારોપણ માટે વઠવાણ પાલિકાના પ્રમુખ ખમ્માબા હરપાલસિંહ લીબેડ હાકલ કરી હતી. જ્યારે વઠવાણ તાલુકા પંચાયત, ગ્રામપંચાયતોને પણ વૃક્ષારોપણ કરવા માટે વન વિભાગે માર્ગદર્શન આપ્યું હતું.

વઠવાણ નર્સરી ખાતેથી એક હજાર છોડનું વિતરણ

વઠવાણ પંથકમાં ૮૫ હજાર વૃક્ષોનું વાવેતર કરવાનું હોવાના ભાગરૂપે શાળાની વિદ્યાર્થીનોને નર્સરી ખાતેથી એક હજાર છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શાખા દ્વારા સેવાના ઉપક્રમ

સ્વાસ્થ્ય : રક્તદાન શિબિર, રક્તગટ સૂચિ (Blood group directory), વૈદ્યકીય સહાય, રૂગણસેવા, સ્વાસ્થ્ય ચિકિત્સા શિબિર, આરોગ્ય પ્રશિક્ષણ, યોગ મશિક્ષણ વર્ગ, રૂગણાલય સંપર્ક, ઔપયુદ્ધ બેંક, પ્રથમોપચાર પ્રશિક્ષણ.

શિક્ષણ : શિક્ષણોપયોગી સામગ્રી વિતરણ, ગ્રોડ સાક્ષરતા, પ્રશ્ન મંજુખા કાર્યક્રમ, વ્યક્તિ વિકાસ શિબિર, ધો. ૧૦થી ૧૨નું પરીક્ષાનું માર્ગદર્શન.

સામાજિક : ભજન, માતૃમંડળી, પરિવાર પ્રબોધન, ગ્રામોત્સવ, અન્નદાન, વૃક્ષારોપણ, મંદિર કેન્દ્રિય કાર્યક્રમ, સામૂહિક ઉત્સવ, ધાર્મિક ગ્રંથ વિતરણ, વ્યસનમુક્તિ શિબિર, યાત્રા વ્યવસ્થા, મંદિર સ્વચ્છતા, વસ્તી/ગ્રામ સફાઈ, શ્રમસાધના, કન્યાપૂજન, ગરીબ કન્યા વિવાહ સહાયતા, જલ-સંધારણ પ્રશિક્ષણ, સેવકાર્ય (પર્યટન) દર્શન, સેવાનિધી સંગ્રહ, પર્યાવરણ જાગરણ, કૃષિસંગ્રહી, તુલસી રોપા વિતરણ.

સ્વાવલંબન : સ્વ સહાયતા સમૂહને સહાયતા, જૈવિક ખાતર નિર્માણ પ્રશિક્ષણ, જૈવિક કૃષિ પ્રશિક્ષણ.

નાગરિકોની ગ્રામ વિકાસમાં ભૂમિકા

ગ્રામ વિકાસમાં શું શું કરી શકાય ?

- (૧) ગામદાનો આધાર ખેતી... (૨) સજીવ ખેતી... (૩) ગાય આધારિત ખેતી... ગોપાલન (૪) ગ્રામીણ સ્વરોજગાર (૫) સમરસ ગામ (૬) સુરક્ષિત ગામ (જળ, જમીન, જાનવર, જંગલ) (૭) પર્યાવરણી સુરક્ષા

ખેતીમાંથી સૈચાએ નિવૃત્તિ લીધા બાદ સમાજેસવા આરંભી

૮૪ વર્ષના વૃક્તે સ્મશાનને બનાવ્યું વૃક્ષોથી હર્યુ-ભર્યુ

ભાસ્કર ન્યૂઝ • મોરબી

મોરબી નજીકના શિવનગરના રણછોડભાઈ પટેલે જાત મહેનતથી સ્મશાનની સિકલ બદલી.

અનોખો કર્મયોગ : ખેતીકામમાંથી નિવૃત્ત થયા બાદ શિવનગરના ખેડૂતે આદર્યો અનોખો સેવાયજી :

સાત વર્ષથી સ્મશાનભૂમિને બનાવી કર્મભૂમિ

સામાન્ય રીતે વૃક્ષાવસ્થા એટલે આરામ કરવાનો સમયગાળો અને પ્રભુ બદ્ધિમાં તલ્લીન બની જવાની અવસ્થા એવી વ્યાખ્યા કરવામાં આવતી હોય છે પરંતુ કંઈક કરી છૂટવાની ભાવના હોય તો ઉમર કે અન્ય કોઈપણ પ્રકારના બંધન જીવનમાં નડતરદૃપ બની શકતા નથી. આવી ઉદાર ભાવનાને ચરિતાર્થ કરતા અનેક પ્રેરણાદાયી કિસ્સાઓ જોવા મળતા હુય છે ત્યારે મોરબી નજીકના એક નાનકડા ગામમાં આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો જોવા મળ્યો છે, જેમાં ૮૪ વર્ષીય વર્ષોવુદ્ધ વડીલ સ્મશાનમાં અનેક સેવાઓ આપીને યુવાનોને અને સમાજને નવી જ રાષ્ટ ચીધે છે.

શિવનગર ગામના રહેવાસી રણછોડભાઈ ગણેશભાઈ પટેલ નામના વડીલ આજે ૮૪ વર્ષની વયે પણ સતત કાર્યશીલ રહીને અનોખી પ્રેરણા ગ્રામજનોને પૂરી પારી રહ્યા છે. આજીવન ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા રહેલા રણછોડભાઈ પટેલે તેના ચાર પુત્રોને કામકાજનો બોજ આપીને છેલ્લા કેટલાક વર્ષોથી નિવૃત્તિ લીધી છે. ગામમાં આવેલા સ્મશાનનું જ વર્ષ અગાઉ રીનોવેશન કરીને નવું બનાવાયું હતું. ત્યારથી આ વડીલે સ્મશાનની સેવામાં તેનું બાકીનું જીવન અર્પણ કરવાનો નિર્ધાર કર્યો હતો. તેઓ રોજ સવારે જ વાગ્યે સ્મશાન ખાતે પહોંચીને તેને વાવેલા અનેક વૃક્ષોને જોતે પાણી પાઈને તેની માવજત કરે છે તો સ્મશાનની સાક્ષ સફાઈ કરવા અને કીડીયારું ભરવા સહિતની સેવા પ્રવૃત્તિઓ તેઓ અવિરતપણે ચલાવી રહ્યા છે. શિયાળો હોય કે ઉનાંનો અને ચોમાસું કોઈપણ ઋતુમાં આ વડીલના સેવાયજીમાં કોઈ રુક્વાટ આવતી નથી.

વરસાદ અંગે પણ સચોટ માહિતી આપે છે

રણછોડભાઈ પટેલ વર્ષોથી ખેતી કરતા હોવાથી તેમને વાતાવરણ અંગે પણ સારું એવું જ્ઞાન છે જેનો લાભ પણ તેઓ ગામના ખેડૂતોને આપી રહ્યા છે. આ વડીલ વરસાદ તેમજ વાવાજોડા અંગે સચોટ આગાહી કરી શકે છે તેમજ ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેમણે આપેલા સમય મુજબ વરસાદ થાય જ

છે. તેમણે કરેલી મોટાભાગની આગાહીઓ સાચી પેડ છે ત્યારે સ્મશાનમાં સફાઈ અને વૃક્ષો વાવીને તેની માવજત કરવા ઉપરાંત આ વડીલ તેમના જ્ઞાનનો લાભ ખેડૂતોને આપીને સમાજની સેવા કરી રહ્યા છે.

સેવા હૈ યજ્ઞકુંડ

સેવા હૈ યજ્ઞકુંડ સમિધા સમ હુમ જલે,
ધ્યેય મહાસાગર મેં સરિત રૂપ હુમ મિલે. (૨)
લોક યોગક્ષેમ હી રાષ્ટ્ર અભય ગાન હૈ,
સેવારત વ્યક્તિ વ્યક્તિ કાર્ય કા હી મ્રાણ હૈ. ॥૪૩॥

ઉચ્ચ નીચ ભેટ ભૂલ એક હુમ સભી રહે,
સહૃજ બંધુભાવ હો રાગ દ્રેષ ના રહે.
સર્વ દિક પ્રકાશ હો જ્ઞાનદીપ બાલ દો,
ચરણ શીંગ દટ બદે ધ્યેય શિખર હુમ ચઢે. ॥૪૧॥

સેવા હૈ યજ્ઞકુંડ...

મુસ્કુરાતે મિલ ઉઠે મુકુલ પાત પાત મેં,
લહર લહર સમ ઉઠે હર પ્રધાત ઘાત મેં,
સ્તુતિ નિંદા લાભ લોભ યશ વિરક્તિ ચાદ સે,
કર્મક્ષેત્ર મેં ચલે સહૃજ સ્નેહ ભાવ સે. ॥૪૨॥

સેવા હૈ યજ્ઞકુંડ...

દીન હીન સેવા હી પરમેષ્ઠ અર્થના,
કેવલ ઉપદેશ નહીં કર્મરૂપ સાધના.
મન વાચા કર્મ સે સહૈવ એકરૂપ હો,
શિવ સુંદર નવ સમાજ વિશ્વ વંદ હુમ ગઢે. ॥૪૩॥

સેવા હૈ યજ્ઞકુંડ...

પબ્લિક્સીટી સ્ટંટ જેવા વૃક્ષારોપણને બદલે સાર્થક જતન ગીન ગાડ

માનવીય હુંફ્થી ઉછરતા ૫૩૦૦૦ વૃક્ષો

એક સમયે રિલીઝ થયેલી 'માંજી-ધ માઉન્ટન મેન'માં એક ઉમદા હેતુ માટે એક વ્યક્તિ જે રીતે પૂરા પહુંચને ચીરી બતાવે છે એ પ્રકારનું જ એક ઉમદા ઉદાહરણ રાજકોટ જિલ્લામાં પણ સર્જઈ રહ્યું છે. દર વર્ષે લાખો વૃક્ષો વવતા હોય છતા રાજ્યમાં જવલ્લે જ આંખ કરે એવા ઉછરેલા વૃક્ષો જોવા મળે છે. ખેર, આ પરિસ્થિતિ વચ્ચે માત્ર ટીકા ટિપ્પણી કરવાને બદલે પડધરી તાલુકામાં 'અપના હુથ જગત્તાથ'ની માફક ૫૩૦૦૦ વૃક્ષોને માત્ર વાવવામાં જ નથી આવ્યા બલ્કે, નાના બાળકોનું જે રીતે જતન કરવામાં આવે એ રીતે તેનો પિંજરામાં રાખી, જરૂરત મુજબ નિયમિત પાણી પાઈ ઉછેર થઈ રહ્યો છે. વૃક્ષો વાવી દેવા એ તો બહુ સહેલી વાત છે, ખરી પ્રક્રિયા એ પછીથી શરૂ થાય છે. પડધરી તાલુકાના વિજયભાઈ ડોબીરીયા આ મિશન વિષે કહે છે કે ૫ જુન ૨૦૧૪ના પર્વવરણા દિવસથી વૃક્ષો વાવવાની શરૂઆત કરી અને આએ પણ હજારથી વધુ વૃક્ષો વાવી ચૂક્યા છે. જે વૃક્ષો અલગ અલગ નર્સીભાંથી લાવીને પડધરી તાલુકાના ફિલેપર, નાની ચાણોલ, મોટી ચાણોલ, જીલીરીયા, હડમતીયા, ખીજડીયા મોટા, સરપદડ, સાલ પીપીયા, રાઢ-હીડ, ઘોકળીયા, ખંભાળા, કેરાળા, ન્યારા, બાધી, તુંગરકા, નારણકા, અડબાલકા, ખાખડાબેલા, ખોડાપીપર, થોરીયાલી જેવા ૨૧થી વધુ ગામના ડામર રોડની બજે બાજુમાં ૨૦-૨૦ ફુટના અંતરે તમજ રોડની

સાઈડમાં આવતા સરકારી ખરાખા, સ્મરાન તેમજ ગોચરનાં વૃક્ષોનું વાવેતર કરવા માટે બે બાય બે ફુટના ખાડા ખોઢી તેમાં કાળી માટી, દેશી ખાતર નાખીને તેમાં સામાન્ય રીતે પ થી ૮ ફુટના વડલા, પીપળા, કરંજ, બોરસલી, આંબલી, ગુંદા, પીપળ, બીલી ઉમરા જેવા અનેક પ્રકારના વૃક્ષો વાવીને તેની બાજુમાં લાડકાના ગાડ એટલે કે લાકડાના પીંજરા જે સામાન્ય રીતે દ થી ૮ ફુટના ઉચા અને મજબુત રાખવામાં

તું યન્તુ નદ્યો વર્ષન્તુ પર્જન્યા:
સુપિપ્પલા ઓષધયો ભવન્તુ ।

નદીઓ વહેતી રહો, વાદળો
તેમના સમયાનુસાર વરસતા રહો.
ઔષધિઓ અને બધી વનસ્પતિઓ
ફળાણી બની રહો.

- કૃષણજુર્વંદ

આવે છે. તેની બાજુમાં, ટોરટાંખરથી બચાવવા માટે બોરડીના કાંટા બાંધવામાં આવે છે અને રેણુલર તેને ટ્રેકટરના ટાંકા દ્વારા પાણી પાવામાં આવે છે. કોઈ કારણસર જેમ કે વાવાંનું વધુ વરસાદ કે કોઈ ટોરથી વૃક્ષનું પીજ પાડી નાખવામાં આવ્યું હોય તો તે ૨૪ કલાકમાં જ વૃક્ષને નુકસાન થયું હોય તો તેને જગ્યા નવું વૃક્ષ વાવીને તેને નવું પીજ નાખી દેવામાં આવે છે. આએ પણ હજારથી વધુ વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. અને કોઈપણ નુકશાની વગર સતત તેની ૨૪ કલાક નજર

રાખવામાં આવે છે. માનવ સેવા - ચેરીટેબલ ટ્રસ્ટની રચના કરીને અનેક જગ્યાએ લોકોને વૃક્ષો વાવીને ઉછેરવા હોય તો તે સાથે રહીને પણ અનેક જગ્યામાં એ જેમકે ટંકારા ગામથી દીરાપર રોડ, ગોડલનું હડમતાળા ગામ, સ્વામીના ગઢાનું ઊગમઠી ગામ, રાજકોટ પોલીસ હેડકવાટર, રાજકોટના કુવાડવા રોડ મારૂતી નગરની સામેના વિસ્તારમાં ૫૦ ફુટ રોડ મધુવન મેઈન રોડ તેમજ સોસાય્ટીમાં વૃક્ષો કંપલીટ સેફ્ટી સાથે ઉછેરવામાં આવી રહ્યા છે. આ વૃક્ષો વાવવા માટે કોઈપણ સરકારી ગ્રાન્ટ વિના કે રાજકારણી કે ધર્મદાતાનો કોઈ ફંડ વિના ૫૩૦૦૦થી વધુ જાત મહેનતથી વૃક્ષોનું વાવેતર થઈ ચુક્યું છે.

દશ કૂપ સચા વાપી

દશ વાપી સમ્ય સર:

દશ સર: સમ્યો પુત્ર

દશ પુત્ર સમ્યો દુધમ:

એટલે કે દસ કૂવા ખોદાવા તે એક વાવ ખોદાવો તે સમાન છે. દસ વાવ એક સરોવર એક સરખા છે. દસ સરોવર સમાન એક સત્પતુન છે પણ દસ પૂત્રોને ઉછેરો અને એક વૃક્ષને ઉછેરો તે સમાન છે.

જે ખેડૂતો ૧૦થી વધુ રોપા વાવીને ઉછેરે તેનું સંમાન થાય છે. લોકો પણ આ લીલોતરી જુબેશમાં જોડાય તે માટે ખેડૂતોને રોપા ઉછેરવા આપવામાં આવે છે. અને જે ખેડૂત ૧૦થી વધુ રોપા વાવીને ઉછેરે તેનું સંન્માન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ૧૬૦૦૦ થી વધુ રોપા કુટના રોપા જેવા કે કલમી આંબા, ચીકું, દાડમ, જામફળ, સીતાકળ, આંબળા અને નારીયલીના રોપા આપવામાં આવ્યાં છે. જેનું સાથે રહીને વાવેતર કરવામાં આવ્યું છે અને તેનું સંપૂર્ણ દેખરેખ રાખવા માટે એક ટીમ રાખવામાં આવેલ છે. આ બધા કલમી રોપા નિઃશુલ્ક આપીને વાવેતર કરી દેવામાં આવે છે.

સૂરજની ટકોર : પર્યાવરણ બચાવો

બધિર બની ચૂકેલા
આપણા વિશ્વને સંભળાતી નથી
નદીઓનું જળ આચમન લાયક રહ્યું નથી.
આપણાને...
પંતંગિયાં અને ટહુકા પ્રત્યે અનુરાગ રહ્યો નથી
ધૂમાડાની ગાળ અને
અવાજોની ચાખુક ખાવાની આદત પડી ચૂકી છે !
પરિસરના ફેફસાં
પેટ્રોલ-ડીજલના ઉત્સર્જ ગંધાય છે
પ્રદૂષણના ઉકરડાથી નસ્ત જંતુઓ
નાક બંધ કરી માસ્ક પહેરી
પર્યાવરણમાં ઊરી રખાં છે !
ડ્રેનેજના પાણીથી
સ્નાન કરી સભ્યતાનાં વસ્તો પહેરી
નન્નતા ઠંકવાનો બ્યથ્પ પ્રયત્ન કરીએ છીએ.
૨૧મી સદીના સૂર્યદર્શન માટે
પરિસરની મોંંદેરી મૂડી બચાવો.
હવા-પાણી-ખોરાક, અવાજ, ઉઘમા,
અવકાશ, જમીન તેમજ માનસિક પ્રદૂષણ રોકો.
પુનઃઅપ્રાપ્ય ઊજાસોનો (કોલસો, બન્નીજ તેલ)નો
વિવેકપૂર્વક ઉપયોગ કરી, પવન ઊર્જા -
સૌર ઊર્જા જ ભાવિ ઊર્જા સંકટનો વિકલ્પ.
તેથી કરીએ સંકલ્પ
પર્યાવરણ બચાવો
વૃક્ષો વાવી CO_2 કરો અલ્પ.
પ્રદૂષિત પર્યાવરણની લગામ તાપાંવા
જનજીવની કાજે ઊજવો -
દરેક પમી જૂને 'વિશ્વ પર્યાવરણ' દિન
ગ્રીન હાઉસ ઈફેક્ટની તીક્ષ્ણ સોયથી
 O_3 (ઓજોન) વાયુ વાદળનાં રંધ્રોને
પરિણામે પીગળશે ધૂવપ્રદેશનો બર્ક,
આથી આખી દુનિયા જગબંબોળ... જગબંબોળ.
રેડિયો વિકરણોનું જોખમ,
પ્રદૂષિત પરિસર સર્જેલું જોખમ,
માનવસર્જિત પ્રદૂષણનું જોખમ -
તત્કષેણે ઘટાડવા, થતો વસ્તીવિસ્ફોટ રોકો

વૃક્ષો ઉગાડો
અભયારણ્યો વિકસાવો
પ્રાણી-પંખીઓને બચાવો
ઈકોલોજી બેલેન્સ જાળવો
નહીં તો...
પ્રદૂષણનો અજગર વિશ્વને ગળી જશો
પર્યાવરણમાં માનવીએ કરેલ હુસ્તક્ષેપ.
બુરેંગ બની કરશે વિશ્વનો સર્વનાશ
આથી જાયા ત્યાંથી સવાર ગણ્યો
માનસિક પ્રદૂષણ દૂર કરી
પર્યાવરણના રક્ષણ અંગે -
આપણી બુઝી બની જતી
સંવેદનાની ધાર તીક્ષ્ણા કરીએ

- રમેશ પટેલ

ગુજરાતનું રાજ્ય વૃક્ષ આંબો

| | |
|--------------|-------------|
| રાજ્ય | રાજ્ય વૃક્ષ |
| આંધ્રપ્રદેશ | લીમડો |
| બિહાર | પીપળો |
| ગુજરાત | આંબો |
| હરિયાણા | પીપળ |
| હિમાચલ | દેવદાર |
| જમ્મ-કાશ્મીર | બદામ |
| ગુજરાત | સાલ |
| કાશ્મીર | ચંદન |
| કેરળ | નાળિયેર |
| મેઘાલય | શેવન |
| મહારાષ્ટ્ર | આંબો |
| ઓરિસ્સા | પીપળો |
| રાજસ્થાન | ખેજરી |
| ઉત્તરપ્રદેશ | અશોકવૃક્ષ |

ગુજરાતમાં સર્વાધિક જોવા મળતા વૃક્ષો

| | |
|------------|-----------|
| ગાંઢો બાવળ | ૪ કરોડ |
| લીમડો | ૩ કરોડ |
| દેશી બાવળ | ૨.૫૦ કરોડ |
| નલગીરી | ૨.૧૭ કરોડ |

નગરને હરિયાણું બનાવવા વૃક્ષારોપણમાં રૂપ સ્વયંસેવકો જોડાયા : પર્યાવરણ જાગૃતિ લાવવા પ્રયાસ કલોલમાં RSSના કાર્યકરોએ ઘેર-ઘેર જઈને ૧૦૦૦ રોપાનું વાવેતર કરી નવી પહેલ શરૂ કરી


પર્યાવરણને થત્તાનું નુકશાનની સીધી અસર છતું ચક ઉપર પડી હોય તેમ ડામાડોળ બની રહેલા છતું ચક ઉપરથી લાગી રહ્યું છે. ત્યારે પર્યાવરણને બચાવવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કલોલમાં અનોખી રીતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રૂપ જેટલા કાર્યકરોએ તોર દુંગે ફરીને દરેકના ધરની ખુલ્લી જગ્યામાં એક વૃક્ષના રોપાનું વાવેતર કર્યું હતું. કલોલમાં આરાએસએસએ ૧૦૦૦ રોપાનું વાવેતર કરીને શહેરને હરિયાણું બનાવવાની પહેલ હાથ ધરી છે.

ગ્લોબલ વોર્મિંગની અસરને પગલે ઓઝોન પડમાં ગાંભડું પડતાં સૂર્યના વિકિરણની સીધી અસર માનવી, પશુ, પક્ષીઓ સહિતના સજીવ જીવ ઉપર પડી રહી છે. ગ્લોબલ વોર્મિંગની અસરની પાછળ છેલ્લા બે દાયકામાં એક ચા બીજા બહાને વૃક્ષાનું નિકંદ્ચન કાઢી નાખવામાં આવ્યું છે. જેને પરિણામે વાતાવરણ અસંતુલિત બની જતા અસાધારણ હવામાનનો અનુભવ લોકો કરી રહ્યા છે. ત્યારે અસંતુલિત બની ગયેલા વાતાવરણને સંતુલનમાં

લાવવા માટે વૃક્ષારોપણની સાથે સાથે તેનો ઉછેર એકમાત્ર ઉપાય બાકી રહ્યો છે. ત્યારે જિલ્લાના કલોલ શહેરને હરિયાણું બનાવવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અભિયાન શરૂ કરીને વૃક્ષારોપણનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. સાધારણ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાપેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને દરેક વ્યક્તિ પોતાના ધર આંગણમાં વૃક્ષના રોપાની વાવણી કરીને તેનો ઉછેર કરે તેવી ભાવનાથી તોર દુંગે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

આરાએસએસ દ્વારા કલોલના દરેકના ધરે જઈને વૃક્ષના એક રોપાની વાવણી કરીને તેની માવજતની સાથે સાથે ઉછેરવા લોકોને અપીલ કરી હતી. સંઘ દ્વારા ધરે ધરે જઈને ૧૦૦૦થી વધારે વૃક્ષોના રોપાનોની વાવણી કરવામાં આવી છે. ઉપરાંત નગરજનોની માંગણીને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પણ ધરે ધરે જઈને વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે. રથ્યાત્રા દરમિયાન સંઘ દ્વારા ૧૦૦ જેટલા રોપાનોનું વિતરણ કર્યું હતું.

મધુવન પ્રભાત શાખા (નટરાજ નગર) રાજકોટ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો રહેવાસીઓ તેમજ આત્મીય કોલેજના એનસીસી કેકેટસ વૃક્ષારોપણમાં જોડાયા



તા. ૧૪-૦૭-૨૦૧૯ના રવિવારના રોજ, મધુવન પ્રભાત શાખા (નટરાજ નગર) રાજકોટ દ્વારા સવારે ૭ થી ૮ સુધી શાખા લાગી હતી. જેમાં માર્થનામાં ૨૮ સંખ્યા હતી.

શાખા પૂર્ણ થયા પછી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં રવીરતન પાર્ક, ગોદન પાર્ક, મોમબાસ પાર્કના ૨૫૦ જેટલા રહેવાસી ભાઈ-ભહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. તેમજ આત્મીય કોલેજના ૧૫૦ જેટલા એનસીસી કેકેટસ (વિદ્યાર્થી ભાઈ-ભહેનો)એ હુઠોલ્લાસ સાથે ભાગ લીધો.

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વિવિધ ઉંડ પ્રકારના આયુરોફિક ઔષધીના કુલ ૪૦૭ વૃક્ષો સ્વયંસેવક શ્રી ભરતભાઈ કોરાટના



માર્ગદર્શન હેઠળ વાવવામાં આવ્યા. વૃક્ષારોપણ દરમિયાન કુલ ૩૫૦ કીલો ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવ્યો તેમજ વૃક્ષને કાયમી ધોરણે પાણી મળી રહે તે માટે પાઈપલાઇનની વ્યવસ્થા કરવામાં આવી છે.

ખર્ચની વ્યવસ્થા આજુભાજુના નિવાસીઓ દ્વારા કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાજકોટ મહાનગરના અધિકારી શ્રી મુકેશભાઈ કામદાર, શ્રી રવીભાઈ, શ્રી ગોપાલભાઈ, શ્રી ભાસ્કરભાઈ, શ્રી જગતભાઈ ઉપસ્થિત રહ્યા હતા.



‘વિસાવદર તાલુકામાં એક મહિનાથી રાહતદરે સિતોરહજાર કિલો ઘાસનું વિતરણ કર્યું છે જે હજુ ચાલુ છે. વધુ માંગ વધતા ત્રણ નવા તેપો શરૂ કર્યા છે. આ સમસ્યા વિષે મને અંગત રસ છે અન આ મુશ્કેલી હળવી કરવા અમે સહિયારો પુરુષાર્થ કરી એક દાખલો બેસાડવા માંગીએ છીએ. ‘આપણો તાલુકા અન્ય વિસ્તાર માટે પ્રેરણારૂપ બને તેવી પ્રભુ પાસે પ્રાર્થના. આપણો હર ભારતવાસી જો મહર્ષિ દ્યાનાં રચિત ગ્રંથ ‘ગો કરુણાનિધિ’ વાંચીએ તો વેદાભૂતના એ વચનોથી જરૂર વિશ્વાસ થશે કે ગૌરક્ષા કરતા દેશના કોઈ બીજા પ્રશ્નની અગત્યતા, અગ્રતા અને ગંભીરતા વધુ નથી.

ગૌશાળા અને પાંજરાપોળ દ્વારા ગાયોની સેવાનું કાર્ય અત્યંત આવશ્યક અને લાભકારી છે. ગાયની સેવા એ પ્રત્યક્ષ દેવતાની પૂજા છે. વિજ્ઞાના આટલા આવિષ્કાર બાદ પણ આજ સુધી એવી કોઈ તકનિક વિકસિત નથી થઈ. અને નથી થઈ શકવાની સંભાવના કે, કોઈ વૈજ્ઞાનિક ધાસચારાને અમૃત જેવા દૂધમાં પરિવર્તિત કરી શકે. જે વસ્તુ મનુષ્ય નથી ખાતો તેને ખાઈને ગાય માતા સમાન અથવા તો તેનાથી અધિક સારું દૂધ પૂર્ણ આહાર સ્વરૂપે આપે છે. માતાનું દૂધ તો કેવળ થોડા મહિના સુધી પ્રામ થાય છે પરંતુ ગાય તો આપણને જીવનભર દૂધ આપે છે. આથી ગાયનું સ્થાન

ગૌ સેવા એ જ રાષ્ટ્ર સેવા

દેશભરની ગૌશાળાઓ પૂર્ણ ક્ષમતા સાથે ગાયો રાખવા માંગે તો પણ અમુક સંખ્યાથી વધુ ગાયો રાખવાનું સંભવ નથી

માતાથી પણ ઉપર છે. આથી જ ગૌ પૂજનીય અને વંદનીય છે. પરંતુ આજે દેશકાળ અને પરિસ્થિતિ અનુસાર કેવળ પૂજા કરીને કે પૂંછે પાણી રેણે જ કર્તવ્ય સાર્થક થયું એમ માનવામાં આવે છે. તેના નિર્વાહિની કોઈને ચિંતા નથી.

ગૌપાલન અને ગૌશાળાની એક સીમા છે. તેની મર્યાદાથી અધિક ગાયો ગૌશાળા નથી રાખી શકતી. દેશભરની ગૌશાળાઓ પૂર્ણ ક્ષમતા સાથે ગાયો રાખવા માંગે તો પણ અમુક સંખ્યાથી વધુ ગાયો રાખવાનું સંભવ નથી. એક સીધીસાદી વાત છે કે જ્યાં સુધી ખેડૂતો ગાયો નહીં પાળે ત્યાં સુધી તે પૂર્ણ ચુરક્ષિત તથા સંવર્ધિત ન થઈ શકે. આજે ભારતની ૭૨% જનસંખ્યા ગામડામાં રહે છે. આ ખેડૂતો શા માટે ગાયો નથી પાળતા? જવાબ સરળ છે. ડેરીવાળાઓ ફેટ પર દૂધના ભાવ ચુકે છે. ગામના દૂધમાં ચરબી નથી આથી તેનું દૂધ કોઈ પસંદ નથી કરતું. પણ નગરજનો એ નથી જાણતા કે ગાયના દૂધ, વી તથા માખણમાં જે પીળો પદાર્થ છે એ શુદ્ધ સ્વર્ગ-તત્ત્વ છે. જે માતાના દૂધ સિવાય દુનિયાના કોઈપણ પદાર્થમાં નથી મળતું. તે બુદ્ધિવર્ધક, બળવર્ધક અને સ્વાસ્થ્યવર્ધક પણ છે. આ દૂધમાંથી બનેલી છાસ અમૃતતુલ્ય છે. હિન્દુસ્થાનમાં દૂધ-દહુંની નદીઓ વહેતી એ ગાયના દૂધની વહેતી બેંસ કે ડોબાના દૂધની નહીં. યાદ રહે કે વિદેશી નસ્લની જર્સી, હોસ્ટીન, ફિજિયન અને ડેવિડબ્રાઉન એ ગાય જેવા પ્રાણી છે તે ગાય નથી અને તેના દૂધ પણ સત્ત્વલિન હોય છે. અસલ ભારતીય ગામોનું દૂધ જ સર્વશ્રેષ્ઠ છે. જેમાં ગીરગાય, રાઠીગાય, સાંચેરગાય,

શાહીવાલ ગાય, સિંહિગાય ઈત્યાદીનો સમાવેશ થાય છે. આ ગાયોના દૂધ ગરમ કરવાથી તેના પોણક તત્ત્વ મૂળરૂપે જ વિદ્યમાન રહે છે જ્યારે બેંસનું દૂધ ગરમ કરવાથી તેના પોણક તત્ત્વો મરી જાય છે. થોડા સમય પહેલાં જ અમેરિકાના કૃષિ વિભાગ દ્વારા એક પુસ્તક પ્રસિદ્ધ થયું છે. ‘The cow is a wonderful laboratory’ (ગૌ એક અદ્ભુત રસાયન શાણ છે.) આ પુસ્તકમાં લાંબું છે કે ‘સમસ્ત ચતુર્પાદ જીવોમાં ગાય એક જ એવી છે કે જેનું આંતરદુ ૧૮૦ ફૂટ લાંબું હોય છે અને તેની વિશેખાતા એ છે કે જે ચારો આવે છે તેનાથી જે દૂધનું નિર્માણ થાય છે એ માતાના દૂધથી પણ વધીને છે. આ ૧૮૦ ફૂટ આંતરડાના પેટાળમાં એ ઘાસ અને બીજા ખાદ્ય પદાર્થોને સમાવી લે છે. આ આંતરડાઓમાં ચાર વિભાગ હોય છે. જેમાંનાં એકને ‘ઓમાસુમ’ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં માઈકોબ્સ અને બેક્ટેરિયા ભર્યા હોય છે. તે ઘાસના ટુકડા અને ઈતર ખાદ્ય વસ્તુઓને ઓગાળીને એસિડયુકટ પ્રવાહી નિર્માણ કરે છે. આ પ્રવાહી બીજા ગ્રાશ વિભાગોમાં પહોંચીને આગળ વધતાં તેમાંથી મલાઈવાળું દૂધ તૈયાર થાય છે. આવું દૂધ મનુષ્યોને શક્તિ, સૌદર્ય અને કોમળતા પ્રદાન કરે છે. પણ સૌથી વિશેખાતા એ મગજના તંતુઓને સમતોલ અને સ્કૂર્ટિવાળા બનાવે છે. સગર્ભા સ્વીઓને મલાઈવાળું ગાયનું દૂધ આપવામાં આવે તો જન્મનાર બાળકનું મગજ બધા જ ગુણતત્ત્વથી સભર બને છે. જ્યારે બેંસના દૂધના મલાઈ અને વી આ કરવામાં સક્ષમ નથી કેમ કે, બેંસના દૂધમાં જુદા જ પ્રકારની

ચરબી નિર્માણ થતી હોય છે. જે લોંગ ચેઈન ફેટ તરીકે ઓળખાય છે અને આવું દૂધ પીવાથી હદ્દ સાથે સંકળાયેલી ઘોરી નસોમાં આ લોંગ ચેઈન ફેટ થીજી જતી હોય છે અને આ કારાણે લોહી પ્રસરાણનો માર્ગ અવરોધાતા હદ્દ રોગનો હુમલો થાય છે.' ગાયના દૂધમાં 'કેરોટૈન' નામનો પદાર્થ ભેંસના દૂધથી દસ ગણો અધિક છે. આ પદાર્થથી મનુષ્યનું યૌવન જળવાઈ રહે છે અને તે સદાબહાર દેખાય છે. આહારના રૂપમાં ગાયના દૂધનું સર્વાધિક વૈજ્ઞાનિક મહત્ત્વ સર્વત્ર રવીકાર કરવામાં આવ્યું છે. જે ઉપાદાનથી શરીરનું યંત્ર ચાલુ રહી શકે એ સધણા તત્ત્વ ગાયના દૂધમાં રહેલા છે. બાળકોના ભોજન માટે ગાયનું દૂધ જ પ્રકૃતિની પહેલી દેન છે. ચરકે તેના ગ્રંથમાં માનવના સ્વાસ્થ્ય અને વિકાસ માટે ગાયનું દૂધ જ સર્વશ્રેષ્ઠ કહ્યું છે. આ પ્રકારે 'ખિટીશ મેડિકલ રિસર્ચ કાઉન્સિલે' એ ઘોષિત કર્યું છે કે, 'ગાયનું વિશુદ્ધ તથા તાજુ દૂધ શરીરને દિલ્લિકર અને પોષક તત્ત્વથી ભરેલું છે અને તેમાં લાભદાયક જીવાણું સહિત બીજા સ્વાસ્થ્યપ્રદ ઉપકરણ હોય છે. ખેરખર ગાય એ હરતું-ફરતું ઔષધાલય છે, જેને આંગણે મર્સીઝ મોટર પડી છે તેનાથી વધુ જેને આંગણે ગાય બાંધી છે એ સુખી છે.'

આજે દેવદૂત જેવા પરદુઃખ ભંજન ડૉક્ટરો બાપડા દઈની પોકારીને કહે છે કે 'ધી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને દૂધ પણ કુદરતી રીતે લેણું તદ્દન અવૈજ્ઞાનિક માટે દૂધને 'ટોન ડાઉન' કરીને તેમાંથી ફાશલ મલાઈ કાઢી નાખીને પાછળ વધેલો સત્તવહિન રગડો ઢીંયવો' આ સાહેબોની ગણતરી ખરી છે, કેમ કે ગોપાલન કરતા લોકો હાથમાં પલાસ્ટીકના મોજા પહેર્યા વગર માખાણ અને ધી તૈયાર કરે છે આનાથી બહેતર છે કે ચંત્રિક પદ્ધતિથી તૈયાર થયું છે ચરબીયુક્ત શુદ્ધ ડાલડા ધીનું સેવન કરવું' કહેવાય છે કે, ગાય-ભેંસના જેટલું દૂધ નથી આપતી, વાત

સીઢી સાદી છે, ગૌ માતા ભૂખ્યા પેટે કેટલું દૂધ આપે?

ભારતીય સંસ્કૃતિનું મૂળ વેદ છે, આથી વિશ્વભરની સંસ્કૃતિઓમાં એ સર્વપ્રાચીન સંસ્કૃતિ છે. વિશ્વમાં કેટલી નવીન સંસ્કૃતિઓ ઉત્પત્ત થઈ સાથે કેટલા ધર્મ-મજહબ ઉત્પત્ત થયા અને કાળના મુખમાં સમાઈ ગયા તેની કોઈ ગાણતરી નથી. જ્યારે આર્થ-હિન્દુ સંસ્કૃતિ ઉપર પણ સમય-સમય પર મોટી-મોટી વિપત્તિઓ આવતી રહી અને ઉત્થાન-પતન પણ થતું રહ્યું છતાં પણ તે આજ સુધી જીવિત છે, આ રહસ્યનું કારણ એક માત્ર ગૌધન જ છે, ગૌધન આર્યનું પ્રધાન ઘન છે, વેદમાં ગાયને 'અવધ્ય' કહી છે, અર્થાત് 'જે વધને યોગ્ય નથી' ગૌમાતા ઈશ્વરનું પ્રત્યક્ષ સ્વરૂપ છે

તેનું પ્રમાણ છે ગાયનો સ્વાભાવિક નિજકામભાવ, તેના ભોજનની સાત્ત્વિકતા તથા સૌ પ્રતિ સમટાણી, મનુષ્ય હુંમેશા તેના વાછરડાને દૂધ પોતું રોકીને તેનું દૂધ દોહી લે છે, છતાં ગૌમાતા તેના સંતાનની પરવા કર્યા વગર આપણાને દૂધ આપી દે છે, તેનો મનુષ્ય તથા તેના વાછરડાને પ્રતિ સમભાવ જ નહીં પણ તે એટલી કલ્યાણકારી અને પરોપકારી છે કે તેના બચ્યાની પણ ઉપેક્ષા કરે છે, પશુપ્રમાણ શરીર ધારણ કરીને પણ તેનો સહજ સ્વભાવ એક બ્રહ્મજ્ઞાતિ તુલ્ય છે, તેના મળ-મૂત્ર પણ શાખોમાં પવિત્ર માનવામાં આવ્યા છે, આથી ગૌરક્ષા એ આર્યત્વની જ રક્ષા છે, આપણે ગાયની રક્ષા કરીશું તો તે આપણી રક્ષા કરશે. અનાવૃદ્ધિ કે અતિવૃદ્ધિ જેવી કુદરતી આફતો આપણી ફસલોને નાશ કરી નાંબે છે અને આપણી આશાઓ પર પાણી ફરી જાય છે, તો પણ જે કાંઈ બચે છે તેમાંથી ગાય આપણા માટે પૌષ્ટિક અને જીવનધારણા કરવા વાળો આહાર તૈયાર કરી દે છે. 'એ હજારો બાળકો માટે ગાય જીવનદાતા છે.' આપણે ગાયની સાધગી, તેના સૌદર્ય અને તેની ઉપયોગિતાને

લઈને તેને પ્રેમ કરીએ છીએ. તેની કૃતક્ષતામાં કયારેય કમી નથી આવી. આપણે જાણીએ છીએ કે ગાય આપણા માટે એક ભિત્તના રૂપમાં છે, જેણે કદી કોઈ અપરાધ નથી કર્યો, એ આપણી પાઈ-પાઈ ચૂકવી દે છે અને ધરની તથા દેશની રક્ષા તો કરે છે પણ મૃત્યુ બાદ જોસેવા આપણી રક્ષા કરે છે. ગોદાન સમયે બોલાતો શાખોકત મંત્ર આ પ્રમાણે છે.

'હે વૈતરણી ગૌ, મહાભયંકર યમદ્વાર પર તુ મારી પ્રતીક્ષા કરજે, હે દ્વીપ હું વૈતરણીને પાર કરવા માંગુ છું, તને નમસ્કાર છે, આ ઉદેશથી હું કૃખણ વૈતરણીઝ્ય ધેનાનું દાન કરું છું, આ વૈતરણી નથી લોહી અને પર્ણની ભરેલી છે, હે માતા મને એ સુખ પૂર્વક પાર કરાવી દે જે.'

તેરીઓમાં આજે ડેબાના દૂધ જ વેચાય છે, તેનું કારણ એ છે કે તેના ભાવનાદીન સંચાલકો ગાયને આર્થિક દિનિએ જુઓ છે, ગાય પ્રત્યે તેને કશો આદર નથી હોતો, કેમ કે પશુઓને તેઓ ઉત્પાદનના સાધનરૂપે જુઓ છે. દૂધ કાન્તિની એક નામી વ્યક્તિ તો ગાયને નકામી માની તેની કંતલ કરવાના પક્ષમાં હતા, બીજો એક વિજ્ઞાનો દાસ આ કેત્ર સાથે સંકળાયેલ હતો તે ભેંસનો એટલો પક્ષપાતી હતો કે વસૂકી ગયેલી ગાયોને દેશ પર બોજ ગણી કંતલ કરવાનું કહી પાડથી બેતી કરવાનું કહેતો, તેમાં તેનો વાંક નથી કેમ કે તે ખુદ પશ્ચિમી વિચારધારાથી પ્રભાવિત હોય છે, તેનું ચાલે તો એ ભારતનું પશ્ચિમીકરણ કરતા વિદેશી નસ્લવાળા માણસોની પણ આયાત કરે, સુશ્રાવક ભિત્રો ગાય હિંદુ સંસ્કૃતિનો પ્રાણ છે એ ગંગા, ગોમતી, ગાયત્રી, ગીતા, ગૌવર્ધન અને ગોવિંદની જેમ પવિત્ર છે, ગાયોના સન્માનની ગાથાઓ આપણા ઈતિહાસમાં બરી પેલી છે.

ધનશ્યામભાઈ સીતાપરા,
મો. ૮૪૨૬૫૭૭૧૭૬

राष्ट्रीय सेवा भारती

वार्षिक कार्यवृत्त २०१८-१९

राष्ट्रीय सेवा भारती-एक परिचय

राष्ट्रीय सेवा भारती आर्थिक दृष्टि से पिछड़े वर्ग, विशेष कर समाजिक न्याय एवं पहचान से वंचित वर्ग, जनजातीय एवं बनवासी समाज के विकास हेतु कार्य करने वाला गैर सरकारी संगठन है। यह नगरीय झुग्गी झोपड़ी एवं पुनर्वास बस्तियों में समाज कल्याण कार्यक्रम : निशुल्क चिकित्सा, निशुल्क शिक्षा, कौशल विकास प्रशिक्षण केन्द्रों के माध्यम से भी कार्यरत है। देश भर के ६०२ जिलों में, इससे संलग्नि ९७३ संस्थाओं द्वारा सेवा कार्य चलाए जा रहे हैं। सभी प्रान्त प्रतिनिधि संस्थाओं द्वारा चलाये जा रहे सेवा कार्यों की संख्या शिक्षा - ११६७०, स्वास्थ्य - ८५६१, सामाजिक - ९४१६, स्वावलंबन - ५९१३, कुल - ३५५६० है।

हमारा दृष्टिकोण : स्वैच्छिक संस्थाओं और समर्पित कार्यकर्ताओं के सामूहिक प्रयास द्वारा देश के पिछड़े, पीड़ित और अभावग्रस्त बंधुओं को शिक्षित, स्वावलंबी और सशक्त कर सुदृढ़ राष्ट्र तथा समरस समाज का निर्माण करना।

हमारा उद्देश्य : अपने साथ संलग्नि स्वयंसेवी संस्थाओं को राष्ट्रीय मंच प्रदान कर, सामूहिकता का भाव जागृत कर, जागरण, सहयोग, प्रशिक्षण एवं अध्ययन द्वारा उनका कौशल बढ़ाना।

हमारे मूल्य : पारदर्शिता, समर्पण, राष्ट्रीय एकता और देश के वैधानिक नियमों का अनुपालन।

हमारी टोली : १८ न्यासी, २८ प्रबन्धन समिति सदस्य, ६ क्षेत्रीय संयोजक, ९ क्षेत्रीय पालक अधिकारी, ४४ प्रान्तीय पुरुष प्रतिनिधि, ७ क्षेत्रीय महिला प्रतिनिधि, ७० प्रान्तीय महिला प्रतिनिधि, ११ विषय समितियां (विभिन्न विषयों पर), ४४ प्रान्तों में प्रान्त प्रतिनिधि संस्था जो अपने प्रान्त में कार्यरत स्वैच्छिक संस्थाओं को राष्ट्रीय सेवा भारती से संलग्न कर, नामित कार्यकर्ताओं द्वारा प्रान्त की संस्थाओं में समन्वय तथा उनके कार्य में सहयोग करती है।

न्यास मण्डल बैठक : वर्ष में ४ न्यास मण्डल बैठके आयोजित की जाती है। इस वर्ष २ जुलाई २०१८ (नई दिल्ली), २२ जुलाई २०१८ (वडोदरा), २२ नवम्बर २०१८ (नई दिल्ली) एवं २४-२५ जनवरी २०१९ (भुवनेश्वर) को न्यास मण्डल बैठकें रही।

जागरण : वर्तमान सामाजिक समस्याओं, क्षेत्रीय एवं राष्ट्रीय स्तर के विषय पर लोगों को जागृत करना। संलग्नि एवं नई संस्थाओं का राज्य और राष्ट्रीय स्तर पर सम्मेलन करना, ताकि उनका उत्साह वर्धन हो और उनको राष्ट्रीय मंच प्रदान करना। समय समय पर हिन्दी एवं अंग्रेजी में साहित्य प्रकाशित करना।

हमारा प्रकाशित साहित्य : सेवा साधना (वार्षिक) - प्रतिवर्ष किसी विशेष विषय पर जैसे स्वावलंबन, महिला सशक्तिकरण, ग्राम विकास, पर्यावरण, बाल-बालिका, सेवा में युवा, रत्न है जल आदि।

सेवा दिशा (५ वर्ष में एक बार) : सेवा संस्थाओं को उनके द्वारा संचालित सेवा प्रकल्पों के आंकड़े। सेवा दिशा-२०१९, इस वर्ष प्रकाशित हुआ। देशभर में मोबाईल एक द्वारा वृत्त-संकलन किया गया।

सेवा कुन्ज (वार्षिक) : संलग्नि संस्थाओं द्वारा संचालित सेवा प्रकल्पों की सफलता की गाथाएं।

सेवा सागर : त्रिमासिक पत्रिका।

हस्तपुस्तिकाएं : बाल कल्याण केन्द्र संचालित सम्बन्धी मार्गदर्शिका, प्रशिक्षण पर पुस्तिका, स्वयं सहायता समूह पर पुस्तिका (वैभवश्री), किशोरियों की समस्याओं और उनके निवारण सम्बन्धी पुस्तिका (समर्थ किशोरी)

सेवा परमोर्ध्म - प्रेरक एवं संस्कारप्रद गाथाएं।

संलग्नि संस्थाओं के वेबसाइट को राष्ट्रीय सेवा भारती के वेबसाइट और अन्य मीडिया साधनों जैसे ट्वीटर, फेसबुक, लिंकइन, यूट्यूब, ब्लाग स्पाट और गूगल प्लस से जोड़ा गया है।

સેવા સંગમ : સમાજ મેં જાગરણ હેતુ અપને સે સંલગ્નિત એવં અન્ય સ્વયંસેવી સંસ્થાઓં કા રાષ્ટ્રીય સેવા સંગમ ૫ વર્ષ મેં એક બાર આયોજિત કિયા જાતા હૈ। ૫ વર્ષ કે અન્તરાલ મેં સભી પ્રાન્તોં મેં પ્રાન્ત સેવા સંગમ કરને કી યોજના રહી હૈ। ઇસ વર્ષ દક્ષિણ બંગ, ગુજરાત, અવધ, ગોરક્ષ, ઝારખણ્ડ, મેરઠ, ઉત્તરાંચલ, હરિયાણા, દક્ષિણ કર્ણાટક, ઉત્તર કર્ણાટક, દક્ષિણ અસમ એવં મણિપુર મેં પ્રાન્ત સેવા સંગમ આયોજિત કિયે ગયે છે। ૨૦૨૦ મેં રાષ્ટ્રીય સેવા સંગમ આયોજિત કરને કી યોજના હૈ। યોજના ટોલી કી બૈઠકે ૨૦ અગસ્ટ ૨૦૧૮ (બેંગલોર) તથા ૨૨ ફરવરી ૨૦૧૯ (નેર્દ દિલ્હી) મેં આયોજિત હુઈ।

સહયોગ : કાર્યશાલાઓં કા આયોજન કરના, જિસમે ઉસ પ્રકલ્પ કે સંબંધિત વિશેષજ્ઞ વિષય કી જાનકારી દેતે હૈને। ઇસકા સુખદ અનુભવ હમ વિભિન્ન વિષયોં જૈસે બાલ કલ્યાણ કેન્દ્ર, કૃષ નિવારણ કેન્દ્ર, ગ્રામ વિકાસ, સ્વયં સહાયતા સમૂહ, નેત્ર દાન આદિ મેં કર ચુકે હૈને। રાષ્ટ્રીય સેવા ભારતી કા રાષ્ટ્રીય કૌશલ નિગમ કે સાથ પ્રશિક્ષણ ભાગીદાર કે રૂપ મેં પંજીકરણ હુઅ હૈ, કૌશલ વિકાસ પ્રશિક્ષણ કેન્દ્ર પ્રારમ્ભ કરને કે લિયે પ્રાન્ત સ્તર પર આવશ્યક કાર્યવાહી કી જા રહી હૈ। સ્વૈચ્છિક સંસ્થાઓં કો CSR કી પૂરી જાનકારી દી જા રહી હૈ, તાકિ વે ભી ઔદ્યોગિક સંસ્થાઓં સે કા CSR લાભ લે સકેં।

સહયોગ કાર્યક્રમ : રાષ્ટ્રીય સેવા ભારતી દ્વારા અખિલ ભારતીય સ્તર પર કિસી વિષય પર કાર્યશાલા હર વર્ષ આયોજિત કી જાતી હૈ। ઇસ વર્ષ ચિકિત્સા એવં ન્યૂરોથેરેપી પર ૮ ક્ષેત્રોં કે ૮૭ કાર્યકર્તાઓં કી કાર્યશાલા, ૧૭, ૧૮ નવમ્બર કો ઝિંગ્ઝોલી તથા ૩ ક્ષેત્રોં કે ૧૨૩ કાર્યકર્તાઓં કી કાર્યશાલા ૧૩, ૧૪ ફરવરી ૨૦૧૯ કો એર્ન્કુલામ, કેરલ મેં આયોજિત કી ગઈ।

મહિલા કાર્ય : ૫-૬ અક્ટૂબર કો વૃંદાવન મેં અખિલ ભારતીય મહિલા પ્રતિનિધિ બૈઠક આયોજિત કી ગઈ। પ્રાન્તોં સે ૧૦ પ્રતિનિધિ ઉપસ્થિત રહે। મા. પરાગ અભ્યંકર જી, શ્રી રાકેશ જૈન, શ્રીમતી ચંદ્રિકા ચૌહાન, શ્રી સુધીર કુમાર, શ્રીમતી અમિતા જૈન, શ્રી કૃષ્ણમૂર્તિ દ્વારા વિભિન્ન વિષયોં પર ચર્ચા એવં પ્રશિક્ષણ હુઅ। સમાપન કાર્યક્રમ પર મા. સુહાસરાવ હિરેમઠજી દ્વારા માર્ગદર્શન કિયા ગયા।

Power Point Presentation દ્વારા સેવા સંસ્થાઓં કે પદાર્થકારીયોં ઔર પ્રકલ્પ પ્રમુખોં કો હિન્દી ઔર અંગ્રેજી મેં પ્રશિક્ષણ દિયા જાતા હૈ। પ્રશિક્ષણ કે મુખ્ય વિષય હૈને - લેખા,

અંકેક્ષણ, ધનસંગ્રહ, પ્રકલ્પ પ્રસ્તાવ લેખન, કાર્યાલય પ્રબન્ધન, પ્રચાર, માનવ સંસાધન, વૃત્ત લેખન, પ્રકલ્પ સંચાલન આદિ। ઇસકે લિયે એક પાઠ્યક્રમ તૈયાર કિયા ગયા હૈ।

ઇસ વર્ષ ૮ ક્ષેત્રોં મેં ૩૦૦ સે અધિક કાર્યકર્તાઓં કા પ્રશિક્ષણ હુઅ। ૧૭ સે ૨૫ દિસ્મ્બર ૨૦૧૮ તક મૈસૂર (કર્ણાટક) મેં અખિલ ભારતીય પ્રશિક્ષક-પ્રશિક્ષણ વર્ગ કા આયોજન હુઅ, જિસમે ૩૦ પ્રાન્તોં સે ૭૨ મહિલાઓં સહિત ૧૭૪ કાર્યકર્તા ઉપસ્થિત રહે।

અધ્યયન : રાષ્ટ્રીય સેવા ભારતી ને મહિલા સમન્વય દ્વારા પ્રસ્તાવિત મહિલાઓં કી શક્ષિક રોજગારી સંબંધી સ્થિતિ કા ખુશાલ મનઃસ્થિતિ ઔર માનસિક સ્વાસ્થ્ય કે બારે મેં અધ્યયન કરને હેતુ કિયે ગયે સર્વેક્ષણ મેં ભાગદારી કી। ૨૯ રાજ્યોં, પાંચ કેન્દ્ર શાસિત પ્રદેશોં કે ૫૩૩ જિલ્લોં મેં કુલ ૬૩,૪૭૩ પત્રક ભરે ગયે, જિને રાષ્ટ્રીય સેવા ભારતી દ્વારા ૪૨ નગરોં કી સંસ્થા સર્વાધિક રહી। એક બહુત હી મહત્વપૂર્ણ જાનકારી સામને આયી કી ૪૪ પ્રતિશત મહિલાયે ખુશ એવં આનંદિત હૈને ઔર ૩૮ પ્રતિશત મહિલાયે અત્યધિક આનંદિત હૈને। ઇસમે અત્યંત વિપરીત પરિસ્થિતિયો મેં રહને વાતી મહિલાયે ભી શામિલ હૈને। મા. ભૈયા જી દ્વારા અપને અનુભવોં કા એક પુસ્તક કે રૂપ મેં સંકલિત કરને કી યોજના પર ભી દિશા પ્રાપ્ત હુઈ।

સંલગ્નિત સંસ્થાઓં કા મૂલ્યાંકન : સંસ્થાઓં કા મૂલ્યાંકન કિયા જાતા હૈ ઔર ઉનેકે પ્રકલ્પ તથા સંસ્થાઓં મેં સુધાર કે રાસ્તે સુઝાયે જાતે હૈને। અસંલગ્નિત સ્વૈચ્છિક સંસ્થાઓં કો ભી આગામી દિનોં મેં સંલગ્નિત કરને કી યોજના હૈ।

આપદા પ્રબંધન : પ્રાકૃતિક એવં માનવ જનિત આપદાયેં સમય-સમય પર સમાજ એવં દેશ પર આતી રહતી હૈને। એસી સ્થિતિ મેં સમાજ કે આપદા પીડિત લોગોં કો આપદા સે બચાને કે લિયે આપદા પ્રબંધન પ્રશિક્ષણ વર્ગ પ્રાન્ત સ્તર પર સમય-સમય પર આયોજિત કિયે જાતે હૈને। સોનીપટ સ્થિત ઝિંગ્ઝોલી એવં દિલ્હી સ્થિત વજીરાબાદ મેં આપદા પ્રબંધન પ્રશિક્ષણ કેન્દ્ર સ્થાપિત કરને કી યોજના પર કાર્ય પ્રગતિ પર હૈ। પ્રાકૃતિક આપદા કે સમય હમ સમ્બંધિત પ્રાન્ત કી પ્રતિનિધિ સંસ્થા સે સમન્વય સ્થાપિત કર જાન માલ કી હાનિ કા આકલન કર સહાયતા ઔર પુનર્વાસ કી યોજના બનાકર કાર્ય કરતે હૈને।

સંઘ સ્થાપના કે પૂર્વ સે હી ડા. હેડગેવાર દ્વારા આપદા મેં સહયોગ કી ભાવના રહી। દામોદર નદી મેં આઈ બાઢ મેં



चिकित्सकों का दल लेकर गये, दवाई भोजन एवं आवश्यक सामग्री का वितरण किया। संघ स्थापना के बाद बी जब भी प्राकृतिक या मानव जनित आपदाए देश में आई, संघ के स्वयंसेवकों द्वारा सहयोग किया गया, तभी आर.एस.एस. को Ready for Selfless Service के नाम से जाना गया। सेवा भारती, सेवा विभाग एवं राष्ट्रीय सेवा भारती की स्थापना के पश्चात् भी आपदाओं में सबसे पहले सहयोग पहुचाने में सक्रिय हैं। संघ के प्रति समाज की विश्वसनीयता बढ़ी है।

इस वर्ष कई आपदायें एक साथ आईं। केरल में आई भीषण बाढ़ में ५५ लाख लोग प्रभावित हुए। ६५ हजार पुरुष, २० हजार महिला कार्यकर्ता सहयोग में लगे। बर्तन, दवाईयां, कम्बल, बिस्तर, खाद्य सामग्री तथा नगद मिलाकर लगभग १३१ करोड़ रु. का सहयोग भेजा गया।

त्रिपुरा में आई भीषण बाढ़ में डा. हेडेगोवार स्मारक समिति - अगरतला द्वारा सहयोग हेतु अनुरोध आने पर छोटी टोली द्वारा तत्काल सहयोग हेतु १० लाख रु. नकद तथा ५००० स्कूल बैग, जिनपर ११,०७,०९५ रुपये व्यव हुए, अगरतला भेजे गये।

ओडिशा में तूफान के कारण आई भीषण आपदा में २१ लाख नगर सहयोग भेजा गया। विजया दशमी पर अमृतसर में सेंकड़ों लोग रेलगाड़ी से कट गये, सैंकड़ों कार्यकर्ता आपदा सहायता में जुटे। आपदा प्रबंधन के प्रशिक्षण हेतु एक दिन, ३ दिन एवं ७ दिन का प्रशिक्षण माडल तैयार किया गया है। वजीराबाद एवं झिंझोली में आपदा प्रबंधन प्रशिक्षण केन्द्र विकसित करने की योजना बनी है। उत्तर पूर्व, पर्वतीय तथा तटीय क्षेत्रों में आपदा प्रबंधन केन्द्र विकसित किये जा रहे हैं। Philanthrope संस्था द्वारा मोबाइल तथा एलईडी बल्बों से

उत्पन्न रेडिएशन के आने वाली आपदा के बारे में भी जागरूक किया जा रहा है।

हितचिन्तक परिवार मिलन : वर्ष भर में १ लाख रुपये या अधिक का योगदान करने वालों की सूची तैयार हुई है। इन्हे हितचिन्तक सदस्य बनाया गया है। २६ मई २०१८ को माननीय दत्तात्रेय होसबाले (सह-सरकार्यवाह) के साथ हितचिन्तक सदस्यों का परिवार मिलन कार्यक्रम कंस्टीट्यूशन क्लब, नई दिल्ली में आयोजित किया गया। ११५ लोंगों की उपस्थिति रही।

श्री हनुमान मंदिर, बजीराबाद का लोकार्पण : १७ जून २०१८ को माननीय भव्या जी जोशी द्वारा स्वामी प्रकाशानन्द सेवाधाम-बजीराबाद, दिल्ली में निर्मित श्री हनुमान मंदिर का लोकार्पण किया गया। १६ जून को जगद्गूरु शंकराचार्य स्वामी राजराजेश्वराश्रम जी महाराज की रथयात्रा एवं १०८ माताओं द्वारा कलश यात्रा का आयोजन हुआ। मंदिर में श्री हनुमान जी, श्री दुर्गा जी एवं श्री शिव परिवार की स्थापना की गई है। सात ही सेवा केन्द्र का निर्माण कार्य प्रारम्भ हो चुका है। प्रशिक्षण एवं शोध केन्द्र की स्थापित करने की योजना है।

झिंझोली : जिला सोनीपत, हरियाणा में श्यामा प्रसाद मुखर्जी ट्रस्ट द्वारा लीज पर दिये परिसर का साथ दो एकड़ अतिरिक्त भूमि क्रय कर उसका नवीनीकरण एवं निर्माण प्रारम्भ हुआ है। परिसर में प्रशिक्षण, शोध केन्द्र एवं आवास व्यवस्था की योजना है।

२३ सितम्बर २०१८ को माननीय सह-सरकार्यवाह डॉ. कृष्णगोपाल जी द्वारा भारत माता मंदिर का शिलान्यास किया गया। मंदिर का निर्माण कार्य चल रहा है। संघ के

પ્રશિક્ષણ વર્ગ, સંકલ્પ દ્વારા ૩૦૦ કાર્યકર્તાઓની પ્રશિક્ષણ વર્ગ, રાષ્ટ્રીય સેવા ભારતી દ્વારા ૮ ક્ષેત્રોની ચિકિત્સા એવં ન્યૂરોથેરેપી ની ૮૭ કાર્યકર્તાઓની કાર્યશાલા આયોજિત હુંદી છે। ૨૦૦ લોગોની આવાસ હેતુ વ્યવસ્થા હૈ।

કાર્યાલય નિર્માણ : કાર્યાલય ભૂમિગત તલ ક્રય કર ઉસમાં સ્થાનાંતરિત કિયા ગયા હૈ। જિસમાં કાર્યાલય કી ગતિવિધિયાં, લેખા વિભાગ તથા વિચાર ગોઢી હેતુ વ્યવસ્થા રહેગી। પ્રથમ તલ કાર્યાલય કી ગતિવિધિયાં હેતુ ક્રય કિયા ગયા હૈ। જિસમાં CSR, Skill, મહિલા કાર્ય તથા યુવા સમિતિ કી ગતિવિધિયાં હેતુ વ્યવસ્થા રહેગી। પાર્કિંગ તલ પર દો કક્ષ નિર્માણ કર કર્મચારીઓની આવાસ એવં ભંડાર કી વ્યવસ્થા કી ગઈ હૈ। ચર્ચર્થ તલ પર પ્રચારકોની તથા અતિથિયાં હેતુ આવાસ રહેગા। પંચમ તલ પર વિશા કક્ષ, જિસમાં ૨૦૦ કાર્યકર્તાઓની બૈઠક હો સકે તથા દો આવાસ કક્ષ નિર્મિત હુએ હૈન્ન, જિનમે મહિલા ન્યાસિયાં હેતુ આવાસ વ્યવસ્થા રહેગી।

આઇયે ચિંતન કરો...

કિસાન મિત્રોની, વૃક્ષ પ્રકૃતિ કે સહઅસ્તિત્વ કે ઘટકોની મેળ્હત્વપૂર્ણ ઘટક હૈ। હમારે પ્રાચીન ગ્રંથો જૈસે મત્સ્યપુરાણ માં ઇસકી મહત્વાના નિમ્ન શ્લોક મેળે વર્ણિત હૈ -

દશકૂપસમા વાપી, દશવાપી સમોહદः ।

દશહૃદસમઃયુતો, દશ પુત્ર સમોદ્ધુમः ॥

દસ કુંઝોની બારાબર એક પોખર હૈ, દસ પોખર એક ઝીલ કે બારાબર। દસ ઝીલ કા મહત્વ એક પુત્ર કે બારાબર હૈ, દસ પુત્ર એક વૃક્ષ કે બારાબર।

ઇસ તરફ અર્થવ્વેદ કે પૃથ્વીસુક્ત મેળે કહા ગયા કી વૃક્ષ ઔર બનસ્પતિ, મનુષ્યોની કી તરફ હી પૃથ્વી પુત્ર હૈન્ન। હમારે દેશ માં વૃક્ષોની પૂજા પ્રાચીનકાલ સે કી જા રહી હૈ। નીમ, બરગદ, પીપળ આદિ વૃક્ષોની અપના એક મહત્વ હૈ। હરિયાલી અમાવસ્યા પર્વ વાસ્તવ મેળે વૃક્ષારોપણ કા હી એક ત્યૌહાર હૈ। અન્ય ગ્રંથો જૈસે બાઇબલ કે અનુસાર પરમેશ્વર કે દ્વારા પૈદા કિયે ગયે વૃક્ષ, ઝાડિયાં ઔર ઘાસ, ફલ તથા બીજ પ્રદાન કરતે હૈન્ન, યે માનવ સમુદ્દરી કે શુભ હૈન્ન। કુરાન મેળે કર્બેલે-પૌર્ણોની જૈસે ખજૂર, જૈતૂન, અંગૂઠા, અનાર, અંજીર, બેરી, પીલૂ, મહેંદી, બબૂલ, તુલસી કા વર્ણન આતા હૈ।

મહાત્મા બુદ્ધ કે જીવન મેળે જન્મ, જ્ઞાન પ્રાપ્તિ, સમાધી કી ઘટનાઓની સાલ, પીપળ વાં જામુન વૃક્ષોની છાયા મેળે હી ઘટ્ટાં।

મહાવીર સ્વામી કો સાલ વૃક્ષ કે નીચે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત હુએ હૈ। સિક્ખ સમાજ મેળે ધારણા હૈન્ન કી ગુરુ કે નામ પર રોપિત વૃક્ષ વાં બાગ લોકમંગલ કરને વાલે હોતે હૈન્ન। પારિજાત વૃક્ષ કા ઉલ્લેખ ગુરુગ્રન્થ સાહિબ મેળે ભી કિયા ગયા હૈ। મધ્યપ્રદેશ કે નિમાડું ક્ષેત્ર કે નામ કા અર્થ હી નીમ કી આડું હૈન્ન। યહાં પર અનેક ગ્રામોની ત્રિવેણી (નીમ, બડું, પીપળ કા એકત્ર) લગાને કી પ્રથા હૈ।

ઇસ સબ કે પીછે એક હી તર્ક/વિજ્ઞાન હૈ કી વૃક્ષ માનવ જાતિ કે અસ્તિત્વ કી રક્ષા નિઃસ્વાર્થ રૂપ સે કરતે હૈન્ન।

ગ્રામીણ ભારત કે હરિત માધુર્ય કો લૌટાને કે લિયે મુખ્ય સુઝાવ :

મેડ (બાડ) ખેતી કો બઢાવા દેકર : મેડ ખેતી વહેં પદ્ધતિ હૈ જિસમાં ખેત કી મેડો પર બહુઉપયોગી લાભકારી વૃક્ષ, ઝાડિયાં કો લગાયા જાતા હૈ।

ઇસકે નિમ્નલિખિત લાભ હૈન્ન -

- ખેત કી સૂક્ષ્મ જલવાયુ સુધરેણી ।
- ભૂમિગત કીટ જૈસે દીમક એવં અન્ય કીટ રોગોની પ્રકોપ કમ હોગ ॥
- વૃક્ષોની જડોની કે કારણ મિટ્ટી કા કટાવ નહીં હોગા ।
- ભૂમિ મેળે જીવાંશ પદાર્થ બઢાને સે જલ ધારણ ક્ષમતા બઢેણી ।
- વાયુરોધક કે રૂપ મેળે હોને સે ઇસસે ગર્મ એવં ઠંડી હવા, આંધી/તૂફાન સે ખેત કી સુરક્ષા હોણી । આંધી તૂફાન કી સ્થિતિ મેળે ફસલોની આડી પડાને કી સમસ્યા કમ હોણી । જલ કા બાણીકરણ બી કમ હોગા ।
- ઇસસે ખેત મેળે કેંચુએં, સૂક્ષ્મ જીવોની વાં અન્ય મિત્ર જીવોની સંબંધાં બઢેણી, ભૂમિ ઉર્વરતા બઢેણી ।
- ખેત મેળે મિત્ર પક્ષીયોની સંરક્ષણ હોગા ।
- પ્રતિ એકડું ખેત કી મેડ પર લાભકારી વૃક્ષોની/ઝાડિયાં કો સંયોજન કર ૧૦-૧૫ હજાર રૂપયે તક વાર્ષિક લાભ કમાયા જા સકતા હૈ ।
- ચારા, ઈધન, ઇમારતી લકડી આદિ પૂર્ણ કી જા સકતી હૈ ।
- વૃક્ષોની ગહરી જડે ગહરાઈ સે પોષક તત્ત્વોની ઊપર લગાકર પૌંધ્યો કો પોષણ પ્રદાન કરતી હૈન્ન ।
- કેવલ મેડ પર ઝાડિયાં લગાકર ફસલોની ઉત્પાદન ૧૫ સે ૨૦ પ્રતિશત તક બઢાયા જા સકતા હૈ ।

સેવા ગતિવિધિયાં

- લગભગ ૨૫ દેશોમાં કાર્યકર્તા સેવા ઇન્ટરનેશનલ વ અન્ય સ્થાનીય સંસ્થાઓનું કે માધ્યમ સેવા વિભિન્ન પ્રકાર કે સેવા કાર્ય ચલતે હૈ જિસમાં અન્નદાન, મંદિર/બગીચા સફાઈ, આવશ્યક શૈક્ષિક તથા રૂણોપયોગી સાહિત્ય કા વિતરણ, રક્તદાન જૈસે કાર્યક્રમ હોતે હુંનું।
- સેવા યુ એસ એ ૩૭ શહરોમાં કાર્યરત હૈ। પિછળે વર્ષ હાર્દી તૂફાન મેં ધ્વસ્ત ઘરોં મેં સે ટેક્સાસ કે બ્રાડોરિઝા કાંટાઈ કે રોષાઆરા ગાંબ કે ૩૫ ઘરોં (૧૫૪ લોગ) કી નવરચના કે લિએ ઉસે અમેરિકન રેડ ક્રોસ દ્વારા ૫,૦૦,૦૦૦ ડાલર કી સહાયતા મિલી હૈ।
- સેવા યુ કે મુખ્ય રૂપ સે વિકલાંગો હેતુ સેવા પ્રકલ્પ સહાયતા મેં કાર્યરત હૈ। પિછળે વર્ષ હુએ પ્રકલ્પોમાં લાતૂર મેં સેરેબ્રલ પાલસી બાલકોનું હેતુ રૂણાલય તથા નેપાલ મેં નુવાકોટ મેં અનાથ બાલકોનું હેતુ છાત્રાવાસ શામિલ હૈ।
- શ્રીલંકા કે ઉત્તરી ક્ષેત્ર મેં બાઢ્યસ્ત દો ગાવોમાં સેવા ઇન્ટરનેશનલ દ્વારા સહાયતા દી ગઈ।
- પિછળે કુછ વર્ષોનું સે મલેશિયા મેં કિર્દી મંદિરોનું કે આસપાસ થાઈપુસમ ઉત્સવ કે સમય અસામાજિક ગતિવિધિયાં બढ્યે રહી થી। ઇસ ઉત્સવ મેં ૩૦ લાખ સે અધિક ભક્ત

સમીક્ષિત હોતે હૈ। ૨૦૧૪ સે એચ એસ મલેશિયા ને સભી હિન્દૂ સંસ્થા તથા મંદિરોનું કો સાથ લોકર થાઈપુસમ ટાસ્ક ફોર્સ TTF કે ગઠન કિયા (જો અબ હિન્દૂ ટાસ્ક ફોર્સ HTF બન ગયા હૈ), તબ સે ઐસી હરકતે કમ હો રહી હૈ। ઇસ વર્ષ પુલિસ કે અનુસાર કોઈ અપરાધિક ગતિવિધિ નહીં હુંદી।

- વર્ષ મેં એક બાર કિર્દી દેશોમાં સ્વયંસેવકોનું સેવા કી ભાવના તથા વ્યવહાર પ્રકટ હો ઇસ હેતુ 'સેવા દિવસ' કા આયોજન કિયા જાતા હૈ। યુ કે મેં ઇસકે આયોજન મેં રક્ત, અવયવ તથા સ્ટેમ પેશીઓનું કે દાન હેતુ કાર્યક્રમ આયોજિત હુએ। સ્થાંમાર મેં ૭૦૦ સ્વયંસેવકોનું ને મંદિર, રૂણાલય તથા શવદાહ કેંદ્ર સફાઈ કે કાર્યક્રમ કિયે। એસે કાર્યક્રમ નોર્વે, જર્મની, કનાડા, મલેશિયા તથા અન્ય દેશોમાં ભી સંપન્ત હુંદી।
- સેવા ઇન્ટરનેશનલ દ્વારા દિલ્હી મેં ૬-૮ દિસ્મબર કો અંતરાષ્ટ્રીય સેવા બૈઠક મેં ૧૪ દેશોનું સે ૫૦ પ્રતિનિધિ ઉપસ્થિત રહે।
- સેવા ઇન્ટરનેશનલ કે ૬ ડાંકટરોનું ને પ્રયાગ કુમ્ભ મેલે મેં ચિકિત્સા સેવા પ્રદાન કી।

બોધ કથા

સમાજકાર્યનો પુરસ્કાર નહીં

આધુનિક કન્નડ સાહિત્યના વિદ્વાન સ્વ. ડી. વી. ગુંડપ્પા એક પ્રસિદ્ધ સમાજસેવક અને પ્રભર પત્રકાર હતા. તત્કાલીન મૈસૂર રાજ્યની રીતિ-નીતિની મોટી નિર્ભીક આલોચના પોતાની પત્રિકામાં કર્યા કરતા હતા. અનેક વખત મૈસૂર સરકારના દીવાન શ્રી વિશેશરૈયાળું એમની પાસે અનેક વિષયો ઉપર લેખ તથા સરકારી પત્ર તૈયાર કરાવતા હતા. સરકાર તરફથી ગુંડપ્પાજીને આભાર પત્ર તથા પુરસ્કારના સ્વરૂપે ચેક પણ મળતો હતો.

સાધારણ ગરીબ પરિવારમાં જીવન વિતાવવાવાળા ગુંડપ્પાજી સમાજકાર્ય માટે પુરસ્કાર લેવાનો સદાય વિરોધ કરતા હતા. પરંતુ સરકારના વધુ પડતા આગ્રહના કારણે તેમણે સ્વીકાર તો કર્યો પરંતુ બેન્કમાં વટાવવાના બદલે તેઓ એક ફાઈલમાં રાખી મુક્તા હતા. તેમના મૃત્યુ પદ્ધી એમના પરિવારજનોને એમની પથારી નીચેથી જુના કાગલો ફંકોસતી વખતે તે બધા જુના ચેકો મળ્યા.

સેવા શિક્ષણ પ્રમુખ કે કાર્ય

**સભી સ્વયંસેવકો મેં સેવા ભાવ જાગૃત કરના ઔર ઉનકો સેવાકાર્ય કરને હેતુ પ્રેરિત કરના,
પ્રશિક્ષણ દેના ઔર સેવા કાર્યોં સે જોડના ।**

(આધાર - ‘સેવા - રીતિ - નીતિ - કાર્યપદ્ધતિ - કાર્યક્રમ’)

(૧) ઉસકે લિયે ૪ અપેક્ષાઓં

અ. સાસાહિક સેવા દિન -

તરુણ ઔર પ્રૌઢ સ્વયંસેવકો કો શાખા મેં દિન નિશ્ચિત કરતે
હુએ પ્રતિ સપ્તાહ ઉસ દિન - શાખા કે કાર્યક્રમ મેં સેવા ગીત,
સુભાષિત, અમૃતવચન કા અભ્યાસ કરના (૧૦ સે ૧૫ મિનિટ)
અન્ય ૧૫-૨૦ મિનિટ મેં ૪ સપ્તાહ મેં ઉસ દિન ચાર કાર્યક્રમ
કરના ।

૧. સેવા કાર્ય - પ્રકલ્પ કા પરિચય દેના ।

૨. સેવા કથા બતાના ।

**૩. મહાપુરૂષોં - સાધ્યિયોં કે જીવન કે સેવા સંસ્મરણ
બતાના ।**

૪. સેવા વિષય પર ચર્ચા કરના ।

આ. સેવા બસ્તી સમ્પર્ક -

શાખા કે બાદ અપની સુવિધા કે સમય મેં શાખા ક્ષેત્ર કી
કિસી એક સેવા બસ્તી મે (ન્યૂનતમ સપ્તાહ મેં એક દિન) સમ્પર્ક
કરના । વહાં કી કમિયાં/આવશ્યકતાઓં કો દેખના ઔર ઉનકી
પૂર્તિ હેતુ આવશ્યક સેવા કે ઉપક્રમ/કાર્ય કરના ।

ઝ. દૃશ્યાનુભૂતિ હેતુ સેવાપર્યટન -

શાખા ક્ષેત્ર કે સ્વયંસેવક ઔર હિતૈષિ લોગોં કો સપરિવાર
લે જાકર (ન્યૂનતમ વર્ષ મેં એક બાર) સેવા પ્રકલ્પ કા દર્શન
કરના ।

ઈ. શ્રવણાનુભૂતિ -

વર્ષ મેં ન્યૂનતમ દો બાર સ્વયંસેવકોં કે સપરિવાર મિલન,
(શરદ પૂર્ણિમા, દીપાવલી આદિ) મેં પ્રત્યક્ષ સેવાપ્રકલ્પ ચલાને
વાલે કાર્યકર્તા (પુરુષ યા મહિલા) કો આમંત્રિત કર ‘સેવા પ્રકલ્પ
કી જાનકારી દેના, સી.ડી. દિખાના ।’

(૨) સેવા પ્રશિક્ષણ વર્ગ ચલાના -

વ્યવસાયી સ્વયંસેવક તથા મહાવિદ્યાલયીન તર્ફણોં કે લિયે
સેવા પ્રશિક્ષણ વર્ગ કરના । ઇસમેં - પાઠદાન કેન્દ્ર, અભ્યાસિકા,
જ્ઞાલો પુસ્તકાલય, ભજન મંડલી, સંસ્કાર કેન્દ્ર, રૂણાલય સંપર્ક
આદિ વિષયોં કા પ્રશિક્ષણ દેના । સેવાબસ્તી દર્શન તથા સર્વેક્ષણ

કા પ્રશિક્ષણ ઔર પ્રત્યક્ષ સર્વેક્ષણ કરવાના ।

(૩) સેવા ઉપક્રમ -

સેવા બસ્તી મેં વહાં કી આવશ્યકતાઓં કી પૂર્તિ હેતુ ઔર
સામાન્ય બસ્તી મેં સેવા મેં સહયોગ કી ટૃષ્ટિ સે ઉપક્રમ કરના । જૈસે
- રક્તદાન શિબીર, સેવા નિધી સંકલન, રૂણાલય સમ્પર્ક આદિ ।

(૪) સેવા સપ્તાહ/પખવાડા/માસ -

ન્યૂનત સભી જિલા કેન્દ્ર તથા તહસિલ કેન્દ્ર મેં વર્ષ મેં એક
બાર યાં કાર્યક્રમ સફળ કરના । વિસ્તૃત જાનકારી કે લિયે
'સેવા વિભાગ રીતિ-નીતિ, કાર્યપદ્ધતિ, કાર્યક્રમ' ઇસ પુસ્તક કા
ઉપયોગ કરે ।

(૫) સેવા સમન્વય -

૧. પ્રાન્ત મેં / જિલા કેન્દ્ર મેં - સંઘ કી યોજના સે કાર્ય
કરને વાતાવી પ્રાંતિય - જિલા સ્તરિય સેવાસંસ્થા - માતૃસંઘટનાઓ
કે પ્રમુખ કાર્યકર્તાઓં સે સંપર્ક રખના । વર્ષ મેં ન્યૂનતમ એક બાર
'સેવા સમન્વય બૈઠક' કરના । ઉસમે અસંપર્કિત ક્ષેત્રોં મેં કાર્ય
પ્રારંભ કરને કી યોજના તથા ક્રિયાન્વયન કરના ।

૨. સ્વયં કી યોજના સે / પ્રેરણ સે સેવાકાર્ય કરનેવાલે
સભી સંસ્થાઓં સે સંપર્ક રખના । ન્યૂનતમ વર્ષ મેં એક બાર ઉનકે
પ્રમુખ કાર્યકર્તાઓં કી બૈઠક કરના ।

૩. ૫ વર્ષોં મેં એકેક વર્ષ પ્રાન્ત સ્તર પર (૧) સેવા સંગમ
(૨) ગો-સેવા સંગમ (૩) ગ્રામવિકાસ (૪) હિન્દુ અધ્યાત્મિક સેવા
મેલા (Hindu Spiritual Service Fair) સંપત્ત કરના । ૫ વે વર્ષ
'રાષ્ટ્રીય સેવા સંગમ' હોતા હૈ ।

માતૃ સંઘટન :

- | | |
|--|-------------------------|
| (૧) વિશ્વ હિંદુ પરિષદ | (૨) વનવાસી કલ્યાણ આશ્રમ |
| (૩) વિદ્યાભારતી | (૪) ભારત વિકાસ પરિષદ |
| (૫) આરોગ્ય ભારતી | (૬) સક્ષમ |
| (૭) રાષ્ટ્ર સેવિકા સમિતિ | |
| (૮) નેશનલ મેડિકોજ ઓર્ગેનાઝેશન (N.M.O.) | |
| (૯) રાષ્ટ્રીય સેવા ભારતી | |
| (૧૦) દીનદયાલ શોધ સંસ્થા (D.R.I.) | |

સક્ષમ : દશકપૂર્તિ પ્રવાસ

શ્રી શિરીષ દારઘેકર

રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્ય, અનુસંધાન સંયોજક, કામ્બા રાષ્ટ્રીય સમિતિ સદસ્ય



સંગઠન કા વિસ્તાર અબ દેશ કે સભી પ્રાંતો કે લાગભગ ૩૦૦ જિલોં મંચ હો ગયા હૈ। સમાજ કે વિભિન્ન ક્ષેત્રોં સે સેવાનિવૃત્ત કાર્યકર્તા, ગૃહણિયાં, વિભિન્ન વ્યવસાયી, ઇત્યાદિ કે સાથ વિભિન્ન શ્રેণી કે દિવ્યાંગ બંધુગણ સક્ષમ કે કાર્ય મં સક્રિય રૂપ સે સહભાગી હોને લગે।

એસા સામાન્યત: નહીં હોતા કિ કિસી સંસ્થા કા ઇતિહાસ ઉસકી સ્થાપના કે પહેલે સે પ્રારંભ હોતા હો। સક્ષમ (સમતૃપ્તિ ક્ષમતા વિકાસ એવં અનુસંધાન મંડલ) યાં સંસ્થા ઇસ વિષય મં અપવાદ કહી જા સકતી હૈ।

સક્ષમ કે કાર્ય કા, યા ચું કહેં કિ વિભિન્ન પ્રકલ્પોં કા, ઇતિહાસ પ્રારંભ હોતા હૈને ફરવરી ૧૯૯૫ સે અર્થાત્ પરમ પૂજનીય શ્રી ગુરુજી (ઉપાખ્ય માધવરાવ સદાશિવરાવ ગોલવલકર), દ્વિતીય સરસંઘચાલક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કી જયંતી કે ઉપલક્ષ્ય મં નાગપુર મં સ્થાપિત પ્રકલ્પ માધવ નેત્રપેઢી સે; સંઘ કે વરિષ્ઠ પદાર્થકારિયોં વિસ્તારોં દ્વારા પ. પૂ. ગુરુજી કી સ્મૃતિ મં યથ પ્રકલ્પ પ્રારંભ કર સમાજ મં નેત્રદાન જનજાગરણ, મરણોપરાંત નેત્રદાન, નેત્ર પ્રત્યારોપણ ઇત્યાદિ સેવા કાર્ય પ્રારંભ કિએ ગાએ। યહાઁ ઉલ્લેખનીય હૈને કિ ઇસ મહાન કાર્ય કે લિએ ડૉ. દત્તત્રેય ઇન્ડોલીકર જી ને અપના નિવાસી મકાન ઉપલબ્ધ કરાયા। ઇસી ભવન મં સક્ષમ કી નોંબ રહ્યી ગઈ।

આજ નાગપુર મં સક્ષમ કી પહ્યાન દરઅસલ માધવ નેત્રપેઢી કે નામ સે હી કી જાતી હૈ। નેત્ર બૈંક કે કાર્યનુભવ કે કારણ હી બાદ મં કોર્નિયા અંધત્વ મુક્ત ભારત અભિયાન (કામ્બા) જૈસા મહત્વાકાંક્ષી

ઉપક્રમ સંગઠન દ્વારા પ્રારંભ કિયા ગયા।

અખિલ ભારતીય દૃષ્ટિહીન કલ્યાણ સંઘ

વર્ષ ૧૯૯૭ મં સંઘ કે સ્વયંસેવકો દ્વારા સમગ્ર દેશ મં દૃષ્ટિબાધિતોં કી સેવા કે ઉદ્દેશ્ય સે સમર્પિત કાર્યકારિણી સદસ્યોં કે પ્રયાસોં સે દેશ મં કર્ડ જિલોં મં સંગઠન કી કાર્ય વિસ્તાર હુઆ। પાલક્રાડ કેરલ મં કૃષ્ણાંજ્યોતિ અગરબાતી નિર્માણ કેન્દ્ર વ દૃષ્ટિ બાધિત વિદ્યાર્થ્યોં કે લિએ છાત્રાવાસ, કાલડી મં દૃષ્ટિબાધિત મહિલાઓં કે લિએ છાત્રાવાસ, નાગપુર મં દૃષ્ટિ બાધિતોં કે લિએ ઑફિયલ કૈસેટ લાઇબ્રેરી, ઇત્યાદિ પ્રકલ્પ પ્રારંભ હુએ। નાગપુર કા માધવ નેત્રપેઢી પ્રકલ્પ અ. ભા. દૃ. ક. સંઘ દ્વારા અંગીકૃત કિયા ગયા। ભારત કે કર્ડ પ્રાંતોં મં નેત્ર બૈંક કી શ્રુંખલા સ્થાપિત કરને કે ઉદ્દેશ્ય સે ૧૦૦ નેત્ર બૈંક સ્થાપિત કરને કા સંકલ્પ કિયા ગયા।

‘સક્ષમ’ કા ઉદ્ય

અલ્પકાલ મં અખિલ ભારતીય દૃષ્ટિહીન કલ્યાણ સંઘ દ્વારા સંચાલિત સેવા કાર્ય કી ગતિ દેખતે હુએ કર્ડ માન્યવરોં દ્વારા સુઝાવ દિયા ગયા કિ ક્યોં ન સભી પ્રકાર કે દિવ્યાંગો કે સેવાર્થ સારે દેશ મં કાર્ય કિયા જાએ? સાથ હી કુછ સુઝાવોં કે અનુસાર ‘દૃષ્ટિહીન’ યાં શબ્દ ભી નકારાત્મક લગતા હૈ અત: સંગઠન કે નામ મં કુછ સકારાત્મક પરિવર્તન ભી આવશ્યક થા। સંઘ જૈસે વैશ્વિક સંગઠન કે દેશ ભર મં વિસ્તાર કા આધાર ધ્યાન મં રહતે હુએ દિવ્યાંગો કે સેવાર્થ દેશવ્યાપી કાર્ય કા સંકલ્પ લેકર દિનાંક ૨૦ જૂન ૨૦૦૮ કો ‘સમતૃપ્તિ ક્ષમતા વિકાસ એવં અનુસંધાન મંડલ (સક્ષમ)’ કી સ્થાપના

की गई। भारत के विभिन्न प्रांतों का प्रतिनिधित्व करते हुए कार्यकारिणी सभासदों से परिपूर्ण सक्षम का कार्य प्रारंभ हुआ।

धीरे-धीरे समर्पित कार्यकर्ता जुड़ते गए और दिव्यांगों की जरूरतों के अनुसार प्रकल्प भी खड़े होते गए। स्थान की कमी महसूस होने लगी। सारा कार्य प्रताप नगर नागपुर स्थित डॉ. इंदोलीकर जी द्वारा दिये गए मकान में किया जा रहा था। संगठन का पंजीकृत कार्यालय श्री अविनाशजी संगवई का निवास स्थान तय किया गया था। बाद में इसे बदल कर १६, देवदत्त भवन, प्रताप नगर, नागपुर ४४००२२ किया गया जहाँ माधव नेत्रपेढ़ी है। सक्षम के मुख्यालय की आवश्यकता को देखते हुए, माधव नेत्रपेढ़ी की स्थापना से निरंतर सेवा समर्पित रहे डॉ. अविनाशचंद्र अग्रहोत्री (जो तत्कालीन राष्ट्रीय महामंत्री थे) द्वारा अपने रविंद्र नगर स्थित रिहायशी निवास की ऊपरी मंजिल सक्षम के अखिल भारतीय कार्यालय हेतु उपयोग में लाने हेतु प्रदान की। संगठन का विस्तार अब देश के सभी प्रांतों के लगभग ३०० जिलों में हो गया है। समाज के विभिन्न क्षेत्रों से सेवानिवृत्त कार्यकर्ता, गृहणीयाँ, विभिन्न व्यवसायी, इत्यादि के साथ विभिन्न श्रेणी के दिव्यांग बंधुगण सक्षम के कार्य में सक्रिय रूप से सहभागी होने लगे।

नागपुर में माधव नेत्रपेढ़ी के अतिरिक्त दृष्टिबाधित विद्यार्थियों के लिए ऑडियो बुक्स लायब्रेरी, ब्रेल ग्रंथ निर्मित, ई-बुक्स निर्मिति, अब्रार, अल्पदृष्टि सेवा, बच्चों की आंखों का तिरछापन के उपचार हेतु, सुर्दर्शन-समदृष्टि प्रकल्प, दिव्यांग रोजगार व स्वयंरोजगार प्रकल्प, दिव्यांगों सहायता केन्द्र इत्यादि प्रकल्प दिव्यांगों की सेवा में प्रारंभ किए गए जिनसे लोग लाभान्वित हो रहे हैं। दि ब्लाईड रिलाफ असोसिएशन नागपुर के साथ सक्षम द्वारा एक नया प्रकल्प माधव नेत्रालय नेत्र संस्थान एवं अनुसंधान केन्द्र हाल ही में प्रारंभ किया गया है। माधव नेत्रालय को एक अलग सेवा संस्था के रूप में पंजीकृत कर यह अंतर्राष्ट्रीय स्तर का नेत्र चिकित्सालय अब नागपुर में कार्यरत है।

नागपुर के अलावा केरल में कृष्णज्योति अगरबत्ती निर्माण, दृष्टिबाधित महिला आवास, मातृज्योति छात्रावास व विद्यालय के अलावा गोवा में सुर्दर्शन-समदृष्टि, ब्रेल ग्रंथ निर्मिति, दिल्ली, अंबाला, कोल्हापुर, अकोला, बैंगलुरु आदि शहरों में दृष्टिबाधित विद्यार्थियों के लिए ऑडियो ग्रंथ निर्मिति, सक्षम के विभिन्न प्रकल्पों की गतिविधि के अतिरिक्त कई कार्यक्रम व उपक्रमों के साथ काम्बा (कॉनिया अंधत्व मुक्त भारत अभियान) इस महत्वाकांक्षी उपक्रम के माध्यम से सक्षम अब तेजी से विस्तारित हो रहा है।

संगठन के कन्याकुमारी अधिवेशन में कार्य को एक वैज्ञानिक

सक्षम - गीत

पूर्ण समावेशी भारत का सपना हमें सजाना है, सक्षम भारत समर्थ भारत यह अभियान चलाना है।

भाव दृष्टि-बाधा से लड़ने का जो मन में आया है, उससे प्रेरित होकर ही कांबा अभियान चलाया है। शुचि परम्परा नेत्र-दान को मिलकर हमें बनाना है, सक्षम भारत समर्थ भारत यह अभियान चलाना है।

दिव्यांगों के स्वावलंब को हमने लक्ष्य बनाया हैं, विविध प्रकोष्ठों की रचना कर नव स्वरूप विकसाया हैं। जिले-जिले में हमको मिलकर सेवा-केन्द्र चलाना है, सक्षम भारत समर्थ भारत यह अभियान चलाना है।

सदा यहाँ दिव्यांग अरूप ने रवि को मार्ग दिखाया हैं, वेद-ऋचाओं के रहस्य को दीर्घतमा ने पाया हैं। स्टीफन हॉकिंग की प्रतिभा का जग ने लोहा माना हैं, सक्षम भारत समर्थ भारत यह अभियान चलाना है।

हम विकास की इस यात्रा में अपना स्थान बनाएंगे, राष्ट्र-देव की उपासना में मिलकर दीप जलाएंगे। पुनः परम वैभव तक भारत माता को पहुँचाना हैं, सक्षम भारत समर्थ भारत यह अभियान चलाना है।

व तर्कपूर्ण दिशा देने के लिए क्षमता विकास प्रकोष्ठ की संकल्पना को कार्यान्वित करने का प्रस्ताव स्वीकृत किया गया। तदनुसार दृष्टिबाधित, श्रवणबाधित, अस्थिबाधित, कुष्ठबाधित व बुद्धिबाधित प्रकोष्ठ देश, प्रान्त और जिला इकाइयों तक प्रारंभ कर उन विषयों पर केन्द्रित गतिविधि प्रारंभ करने पर ध्यान केन्द्रित किया गया।

नई दिल्ली (दृष्टिबाधित), जबलपुर में धीमहि नाम से (बुद्धिबाधित), पुणे में प्रणव नाम से (श्रवणबाधित), चैन्नई में (कुष्ठबाधित) इत्यादि प्रकोष्ठवार राष्ट्रीय कार्यशालाओं का आयोजन कर संगठन ने सारे देश में दिव्यांग क्षेत्र को एक नई दिशा दी।

‘सेवा के ज़ज़कुंड में समिधा जो जलती है,
- उस पवित्र समर्पण से ही संस्था चलती है !’

दशकपूर्ति का पुनरावलोकन करते हुए हमें सदैव स्मरण रहता है हमारे उन कार्यकर्ताओं का जिन्होंने सेवा कार्य करते हुए अपने प्राण भी समर्पित कर दिए।

‘कार्यकर्ता माध्यम है, ईश्वर का हाथ है,
कोई दिव्यांग नहीं जब ‘सक्षम’ का साथ है !’

સ્ત્રીઓની સમસ્યા : શૈતપ્રદર

વૈદ્ય જહિનવીબેન ભહુ, મો. ૯૪૨૮૫૬૮૦૦૮

આજે આપણે સ્ત્રીઓને મૂંજવાણમાં મૂકી દેનાર બે રોગો વિશે વાત કરવાનાં છીએ. જેમાના એક રોગમાં સ્ત્રીના શરીરમાંથી યોનિ મારફતે સફેદ પાણીનો પુષ્કળ પ્રમાણમાં સાવ થયા કરે છે. જેથી સ્ત્રીનું શરીર નબજું પડી જાય છે. તેને પેઢું અને કમરમાં દુઃખવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ રોગને આયુર્વેદમાં ‘શૈતપ્રદર’ તરીકે ઓળખવામાં આવે છે. તે જ રીતે યોનિ મારફતે જ્યારે વધારે પ્રમાણમાં રક્તનો સાવ થાય ત્યારે તેને ‘રક્તપ્રદર’ તરીકે ઓળખવામાં આવે છે. વધારે પ્રમાણમાં શરીરમાંથી રક્ત ઓછું થઈ જવાથી સ્ત્રીઓ એનિમિયા-પાંદુરોગ, અશક્તિ વગેરેનો ભોગ બની શકે છે.

સ્ત્રીનાં શરીરને ફૂશ કરી નાખનાર આ રોગોનો જો શરૂઆતથી જ યોગ્ય ઉપયાર શરૂ કરી દીધો હોય તો સામાન્ય ઘરગથું ઉપયારોથી જ આ રોગ મટી શકે છે. પરંતુ જો તે જૂનો થાય તો ગંભીરરૂપ ઘારણ કરી કેન્સર જેવા રોગનું કારણ બને છે. શરૂઆતમાં નીચે બતાવેલાં ઉપાયોમાંથી જે સરળ લાગે તે ર થી તું ઉપાયો સાથે કરવાથી ત્વરિત પરિણામ મેળવી શકાય છે.

જેમાં નીચે મુજબના ઉપાયો હું સૂચયું છું - જેમાં

(૧) નાગકેસરને ર થી ત ગ્રામની માત્રામાં છાશ સાથે લેવું તથા ખોરાકમાં

‘ધાશ-ભાત’ લેવાં.

(૨) લોહ ચૂર્ઝ ૧ ચમચી અને સાકર ૧ ચમચી માત્રામાં લઈ ચોખાના ઓસામણામાં મેળવી લેવું.

(૩) કેરીની ગોટલીનું ચૂર્ઝ પા-પા તોલો પ્રમાણમાં દિવસમાં ત્રણવાર લેવું.

(૪) જીરું અને સાકર સમભાગ ચૂર્ઝ કરી ૧ તોલો ચોખાના ધોવાણમાં પીવાથી રક્તપ્રદર અને શૈતપ્રદર બંને મટે છે. અને ગર્ભનાં દોપોનું પણ નિવારણ થાય છે.

- શતપાત્રી ચૂર્ઝ દૂધમાં ૧ - ૧ ચમચી સવાર-સાંજ લેવું.

- આમળાનું ચૂર્ઝ ૧ - ૧ ચમચી સવાર-સાંજ લેવું.

- જેઠીમધ ૫ ગ્રામ, સાકર ૧૦ ગ્રામને ચોખાના ઓસામણ સાથે લેવું.

- ૬ ગ્રામ નાગકેસરનું ચૂર્ઝ માખણ અને સાકરમાં નિયમિત રીતે લેવાથી પણ આ રોગમાં ખૂબ ફાયદો થાય છે.

- બોબરના ફળનું ચૂર્ઝ માખણ સાથે ૧ - ૧ ચમચી આપવું.

- વડની લીલી છાલ દ ગ્રામ મધ સાથે સવાર-સાંજ આપવી.

- તાંદળજાની ભાજના મૂળનો રસ અડધો-અડધો તોલો અને જેઠીમધનું ચૂર્ઝ પોણોતોલો મધ સાથે લેવાથી બધી જ જાતના પ્રદરરોગ મટે છે.

- રક્તપ્રદર માટે વડની વડવાઈનું ચૂર્ઝ સાકર અને દૂધ સાથે લેવું તેનાથી ગમે

તેવો પ્રદર હોય તો પણ તેમાં ફાયદો થાય છે.

- આંબાની છાલનું ચૂર્ઝ પાણી સાથે લેવું અથવા છાલ પલાણી પીવાથી રક્તપ્રદર મટે છે.
- કમળકાકડી દ ગ્રામ માત્રામાં લઈ સાકર સાથે દૂધ અને પાણીમાં તેની ખીર બનાવી ખાવાથી પ્રદરરોગમાં ખૂબ જ અસરકારક ફાયદો થાય છે.
- દરેક પ્રકારનાં પ્રદર રોગમાં ઈસભગુલ અને સાકર પાણીમાં ભૌજવી રખી પછી તે લેવું.
- જાંબુદી અથવા દાડમિની છાલનો ઉકાણો પણ પ્રદરમાં શ્રેષ્ઠ અસરકારક સાબિત થયેલ છે.
- શૈતપ્રદરમાં રસવંતીને ચોખાના ધોવાણ સાથે દરરોજ સવારે લેવી જેથી ધાળો જ ફાયદો જાણારે.
- અડધો તોલો ત્રિફળાનું ચૂર્ઝ વહેલી સવારે લેવું.
- રાજગરાની ભાજનો રસ, ખાંડ બેળવી કે સાકર નાખી ર૨૫ થી ૩૦ ગ્રામ પ્રમાણમાં લેવો. જે દરેક પ્રકારના પ્રદર ઉપર અસરકારક છે.
- બહુફળીનું ચૂર્ઝ સાકર સાથે ૧ - ૧ તોલો દૂધ સાથે સવાર-સાંજ લેવું. સમભાગ પ્રદરરોગની આ ઉત્તમ દવા છે.
- પ્રદર રોગમાં કંસકીનું મૂળ ગાયના દૂધમાં ઉકાળીને લેવાથી ધાળો જ ફાયદો થાય છે.
- ગળો ચૂર્ઝ ૧ - ૧ ચમચી મધ સાથે લેવાથી બંને પ્રદરમાં અસરકારક છે.
- આમળાનો રસ સાકર સાથે લેવો તેમજ અજમો અને લોહચૂર્ઝ મદ સાથે લેવું.

- આમળાનું ચૂર્ણ કેળા સાથે લેવાથી પણ શેતપદની સમસ્યા મટી શકે છે.
- સાલમ મૂસળી, ઘોળી મૂસળી અને શતાવરીનું સમાન ભાગ ચૂર્ણ કરીને તેમાંથી ૧ - ૧ ચમચી ત્રાણવાર ગુલકંદની જેમ ખાવું. જેથી પ્રદરોગમાં ખૂબ જ ફાયદો જણાશે.
- કેવડાનાં મૂળનાં રસમાં સાકર મેળવીને પીવું.
- માયાફળ છ નંગા, ઘાવડીના ફૂલ,
- લાલ જાસુદના ફૂલ અને સાકર કશ કરી તેમાં લોંબુ નીચોવી રાખો તેમાંથી ૧ - ૧ ચમચી ત્રાણવાર ગુલકંદની જેમ ખાવું. જેથી પ્રદરોગમાં ખૂબ જ ફાયદો જણાશે.
- કેવડાનાં મૂળનાં રસમાં સાકર મેળવીને પીવું.
- રસવંતી, વાંસકપૂર ૧૦ - ૧૦ ગ્રામ લઈ ચૂર્ણ કરી રાખવું. આ ચૂર્ણમાંથી ૧ - ૧ ચમચી ચૂર્ણ ચોખાના ઓસામણમાં સવાર-સાંજ લેવું. જો પ્રદરનું પ્રમાણ વધારે હોય તો ચાર-ચાર કલાકનાં અંતરે પણ આ ચૂર્ણ લઈ શકાય છે.

આશુરોધિક દોહા

- દહીં મથે માખન મિલે, કેસર સંગ મિલાય, છોઠો પર લેપિત કરે, રંગ ગુલાબી આય...
- બહુતી ચંદ્ર જો નાક હો, બહુત બુરા હો હાલ, ચુકેલિએસ તેલ લેં, સુંદે ડાલ રહ્માલ...
- અજવાઈન કો પીસીયે, ગાડા લેપ લગાય, ચર્મ રોગ સબ દૂર હો, તન કંચન બન જાય...
- અજવાઈન કો પીસ લેં, નીંબુ સંગ મિલાય, ફોડા-કુંસી દૂર હોં, સબી બલા ટલ જાય...
- અજવાઈન-ગુડ ખાઈએ, તબી બને કુછ કામ, પિત રોગ મેં લાભ હો, પાયેંગો આરામ...
- ઠંડ લગે જબ આપકો, સર્દી સે બેહાલ, નીંબુ મધુ કે સાથ મેં, અદરક પિયે ઉભાલ...
- અદરક કા રસ લિંજિયે, મધુ લેવે સમભાગ, નિયમિત સેવન જબ કરેં, સર્દી જાય ભાગ...
- રોટી મક્કે કી ભવી, ખા લેં ચંદ્ર ભરપૂર, બેહતર લીધર આપકા, ટી.બી. બી હો દુર...
- ગાજર રસ સંગ આંવલા, બીસ ઔં ચાલિસ ગ્રામ, રક્તચાપ હિંદદય સહી, પાયેં સબ આરામ...
- શહેદ આંવલા જૂસ હો, મિશ્રી સબ દસ ગ્રામ, બીસ ગ્રામ દી સાથ મેં, ચૌવન સ્થિર કામ...
- ચિંતિત હોતા ક્યોં ભલા, દેખ બુટાપા રોચ, ચૌલાઈ પાલક ભવી, ચૌવન સ્થિર હોય...
- લાલ ટમાટર લીજુએ, ખીરા સહિત સ્નેહ, જુસ કરેલા હાથ હો, દુર રહે મધુમેહ...
- પ્રાતઃ સંદ્યા કીજુએ, ખાલી પેટ સનેહ, જામુન-ગુઢલી પીસિયે, નહીં રહે મધુમેહ...
- ધઉં ખાવાથી શરીર ફૂલે, ને જવ ખાવાથી જુલે, મગને ચોખા ના ભૂલે, તો બુદ્ધિના બારણા ખુલે...
- ધઉંને તો પરદેશી જાણું, જવ છે દેશી ખાણું, મગની દાળને ચોખા મળે, તો લાંબુ જુવી જાણું...
- ગાયના દીમાં રસોઈ રાંધો, તો શરીરનો મજબૂત બાંધો, ને તલના તેલની માલીશથી, દુઃખે નહીં એકેચ સાંધો...
- ગાયનું દી છે પીળું સોનું, ને મલાઈ નું દી ચાંદી, હવે વનસ્પતિ દી ખાઈને, થાય સારી દુનિયા માંદી...
- મગ કહે હું લીલો દાણો, ને મારે માથે ચાંદુ, બે-ચાર મહિના મને ખાય, તો માણસ ઉઠાડું માંદુ...
- ચણો કહે હું ખરબચાડો, મારો પીળો રંગ જણાય, જો રોજ પલાણી મને ખાય, તો ઘોડા જેવા થાય...
- રસોઈ રાંધે જો પીતળમાં, ને પાણી ઉકાળે તાંબુ, જે લોજન કરે કાંસામાં, તો જુવન માણે લાંબુ...
- ધર ધરમાં રોગના ખાટલા, ને દવાખાના માં બાટલા, ઝીજ ના ઠંડા પાણી પીને, ભૂલી ગયા છે માટલા...
- પૂર્વ ઓશિકે વિધા મળે, દક્ષિણે ધન કમાય, પદ્ધિમે ચિંતા ઉપજે, ઉત્તરે હાનિ થાય..
- ઉંધો સુવે તે અભાગીયો, ચતો સુવે તે રોગી, ડાબે તો સહુ કોઈ સૂવે, જમણે સુવે તો યોગી...
- આહાર એ જ ઔષધ છે, ત્વાં દવાનું શું કામ, આહાર વિહાર અજ્ઞાનથી, દવાખાના થયા છે જામ...
- રાત્રે વહેલા જે સુવે, વહેલા ઉઠે તે વીર, પ્રભુ ભજન પછી ભોજન, કહેવાય એ નરવીર...

વैद्यकीय सेवाथी समाज परिवर्तन

ડો અશોકજી કુકેડે, ભારત સરકાર પદ્મભૂષણ

સ્વતંત્રતા મહિને ૭ દાયકા પછી પણ આપણા દેશમાં અનેક સ્તરે સામાજિક પરિવર્તનને લઈ ચર્ચા થાય છે. આ દાખીથી કેટલાક પ્રયત્નો પણ થઈ રહ્યા છે અને તેની અસર પણ દેખાઈ રહી છે. આપણી દાખીએ સામાજિક પરિવર્તન એટલે સમાજની સામૂહિક માનસિકતાનું પરિવર્તન અને તે પ્રમાણે સમાન્ય જીવન વ્યવહારમાં પણ પરિવર્તન છે. તેના માધ્યમથી વ્યક્તિ, પરિવાર અને સમાજની ઉત્ત્રતિ થવી જોઈએ. આવા અનેક પ્રયાસો સરકાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા એકલા અને સંયुક્ત રીતે થયા છે. કેટલાક સ્થાનો પર વ્યક્તિગત પ્રયાસો પણ થયા છે. આ ઉપરાંત પરિવારો અને શૈક્ષણિક સંસ્થાઓના માધ્યમથી પણ પ્રયાસો થયા છે. આમ અનેક પ્રયાસોના કારણે સારા પરિણામો પણ દેખાઈ રહ્યા છે. છતાં પણ સ્વીકારવું જ રહ્યું કે સંતોષજનક પરિવર્તન કરવામાં ભારતીય સમાજ અને ખાસ કરીને હિન્દુ સમાજ નિષ્ફળ રહ્યો છે.

છેદા ૫૦ વર્ષથી ચિકિત્સા વ્યવસાય સાથે જોડાયેલો છું. વ્યવસાયનું સ્વરૂપ ચીલાચાલુ ન રાખતા સામૂહિક, સંગઠનાત્મક તથા સંસ્થાગત કરવાનો પ્રયાસ સંઘના ચિકિત્સક સ્વયંસેવકોએ કર્યો. સંઘના એક સ્વયંસેવક હોવાના નાતે આપણે જે સંસ્કાર મેળવ્યા છે, તેમને આધાર બનાવી સંગઠન રૂપે સામાજિક સેવાનો ભાવ રાખી વૈદ્યકીય વ્યવસાય કરવાની ચેષ્ટા કરી છે. આ માધ્યમ દ્વારા સમાજમાં સંસ્કાર તથા ભાવ જાગરાશ કરવાની દખ્ટી અમે અપનાવી છે. સામાજિક પરિવર્તનની પ્રક્રિયા ઉચ્ચિત સામાજિક સંસ્કાર દ્વારા જ સંભવ બને છે. છેદા ૫૦ વર્ષના વૈદ્યકીય વ્યવસાય દરમયાન વિવિધ પ્રયોગો તથા પ્રયાસો દ્વારા સામાજિક પરિવર્તનના કાર્ય મહુદાંશે સફળ રહ્યા છે.

વૈદ્યકીય ચિકિત્સા અને વ્યવસાયનું સમાજમાં એક વિશિષ્ટ સ્થાન છે. તેને ઉદ્દાત વ્યવસાય (નોભલ પ્રોફેશન) કહેવામાં આવે છે. મનુષ્યની વ્યાધિ અને વ્યથાથી જોડાયેલ આ વ્યવસાય હોવાથી તેને મહત્વ મળેલું છે. આથી માત્ર રોગ

જ નહિ મૂત્યની સાથે સંબંધ પણ આ વ્યવસાય કરે છે. આપણે ત્યાં એક સુભાષિત છે કે વૈદ્યો નારાયણો હરિઃ। આથી ચિકિત્સકને લોકો ભગવાનના સમાન માને છે. આથી ચિકિત્સક અને રોગીની સાથે એક નિકટનો સંબંધ હોય છે. મેં તેનો વ્યાપક અનુભવ કર્યો છે. ચિકિત્સક માટે શ્રદ્ધા વ્યક્તિગત અને પારિવારિક સ્તરે સ્થાપિત થાય છે અને એક ભાવનાત્મક સંબંધ બંધાય છે. જો ચિકિત્સકનો વ્યવહાર આત્મીયતા પૂર્ણ અને નિઃસ્વાર્થ ભાવથી પરિપૂર્ણ હોય તો તેનું સ્થાન પરિવાર તથા સમાજમાં માર્ગદર્શક અને હિતેસછુ તરીકે બને છે. આમ ચિકિત્સક તેના પરિવારના જીવનમાં પરિવર્તન લાવવાનું માધ્યમ બને છે.

ચિકિત્સા વ્યવસાયના આ રહસ્યને ખિસ્તી મિશનરીઓએ ૨૦૦-૩૦૦ વર્ષથી ઊંડાણપૂર્વક સમજી લીધો હોતો અને વિશવાં અનેક અવિકસિત દેશોના ઉપેક્ષિત અને અભાવથ્રસ્ત લોકીમાં માતાપણા માટે હુષિયાર સ્વરૂપે પ્રયોગ કર્યો. મિશનરીના શિક્ષણમાં એક વાક્ય બહુ પ્રચલિત છે - Medicine is the right hand of Gospel. વૈદ્યકીય ચિકિત્સા ચર્ચ અથવા ખિસ્તી મતના પ્રચારનો જમાણો હુથ અર્થાત મુખ્ય સાધન છે. આ સાધનનો ઉપયોગ ઈસાઈ મતના પ્રચારના માટે મહુદાંશે સફળ રહ્યો છે. આ ઉચ્ચિત છે કે અનુચિત તેની વિવેચના અહીં કરવામાં આવી નથી.

છેદા ૧૦૦ વર્ષથી આપણા સમાજ માટે વૈદ્યકીય સેવા દ્વારા અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓએ વ્યાપક પ્રયાસ કર્યા છે. આ વિષયના પ્રથમ પ્રેરક સ્વામિ વિવેકાનંદ હતા. તેમણે સેવાક્ષેત્રનું મહત્વ સમજી તેને સમાજ પરિવર્તનના એક સાધન તરીકે પ્રયોગ કરવાનો પ્રારંભ કર્યો. તેમાં વૈદ્યકીય સેવાનું મોહું મહત્વ રહ્યું. આથી તેમના શિષ્યો તેમના દ્વારા સ્થાપેલા રામકૃષ્ણા મિશનના માધ્યમથી વૈદ્યકીય સેવાથી સામાજિક પરિવર્તનનું સફળ પ્રયોગ કરી શક્યા. આપણા સૌ માટે આ પ્રયાસ આજે પણ માર્ગદર્શક છે.

વિવિધ વિચારધારાઓના લોકો તેઓની પ્રેરણા લઈ સેવાના આજ રીતના વ્યાપક સ્વરૂપ ઉભું કરવા સફળ રહ્યા છે. બાબા આમ્ટેનું નામ સૌ જાણે છે. કુઝ પોડિતોની સેવામાં સમર્પિત આમ્ટે પરિવારે છેલ્લા ૬૦ વર્ષોમાં વ્યાપક સામાજિક પરિવર્તનનું નક્કર ઉદ્ઘારણ મસ્તુત કર્યું છે. આજ પ્રમાણે ડૉ. અભય બંગ એક સર્વોદ્યમી પરિવારમાં જન્મીને, આ જ સંસ્કારોના કારણે વિદર્ભના ઉપેક્ષિત ક્ષેત્રમાં વ્યાપક પરિવર્તન કરવામાં સફળ રહ્યા. વૈદ્યકીય સેવા દ્વારા રોગમુક્તિ પ્રાથમિક ઉદ્દેશ્ય રહે છે. તેની સાથે સાથે પ્રબોધન પણ થાય છે, જે આગળ જતા શિક્ષણનો પસાર થાય છે અને વ્યાપક જીવનની ઉત્તેજિતો અનુભવ મળે છે. આવા વ્યક્તિત્વની પ્રયાસ જ્યારે સંગાઈ થાય છે, તો તેના પરિણામ સઘન અને કેટલાય ગણા સારા હોય છે. તે આપણે બધા અનુભવ કરી શકીએ છીએ.

આ પ્રયાસોમાં સમાજ પણ ઘણો સહાયક થાય છે. સંપૂર્ણ ભારતમાં આવા કેટલાંય પ્રયાસ સફળતા પૂર્વક ચાલે છે. વિદેશોમાં રહેતા ભારતીય બંધુઓ પણ આવા કાર્યોમાં સહયોગ કરી રહ્યા છે.

શું સંભ વિચારથી કામ કરતા કાર્યકર્તા અને સંગઠન આ ક્ષેત્રમાં કાંઈ પ્રભાવી કામ કરી શક્યા છે? આ સાચ્યું છે કે આ ક્ષેત્રમાં આપણે ખૂબ મોડા આવ્યાં છીએ. લાતુરમાં ‘વિવેકાનંદ રુગ્ણાલય’ ના માધ્યમથી છેલ્લા ૫૦ વર્ષોથી આપણે કાર્યરત છીએ. સંભાળનગર (ઔરંગાબાદ) માં ડૉ હેઠેવાર રુગ્ણાલયનો સફળ પ્રયાસ છેલ્લા ૨૫ વર્ષોથી ચાલી રહ્યો છે. બંને સ્થાનોનો અનુભવ આપણા માટે માર્ગદર્શક છે. આ પ્રકલ્પો પર લોકો સારવાર માટે આવે છે અને તેઓ આપણી સેવા પદ્ધતિની વિશેષતાનો અનુભવ કરે છે. જો કોઈપણ સ્તરે વિરોધ હોય તો તે ધીરે ધીરે ઓછો થઈ જાય છે. પછી લોકો વિચારથી જોડાય છે. તેના દ્વારા સક્રિય શક્તિનું સંગઠન મજબૂત થતું જાય છે. કર્મચારીઓ તથા નજીકના લોકોના જીવનની પ્રગતિ થાય છે. સેવાભાવ, આત્મીયતા અને સંગઠનો અનુભવ થવાથી યોગ્ય સંસ્કાર પણ વિકસિત થાય છે. પરિણામ સ્વરૂપ આપણે સામાજિક

પરિવર્તનનો વ્યાપક અનુભવ કરી શકીએ છીએ. હાલમાં આપણાં દેશમાં આપણી યોજનાથી ચાલતા ૫૦-૬૦ પ્રસ્થાપિત વૈદ્યકીય પ્રકલ્પ છે. છેલ્લા ૧૦ વર્ષોથી આવા કાર્યકર્તાઓની કાર્યક્ષમાતાઓમાં અનુભવોની આપ-લે અને પરિષદ કાર્યકર્તાઓના માર્ગદર્શનની વ્યવસ્થા થઈ રહી છે. ‘રક્તાધાન’ (બ્લડ ટ્રાન્સ્ફ્રુજન સર્વિસીસ)નો અલગથી ઉદ્દેશ્ય કરવા માંગું છું. આખા દેશમાં સ્વયંસેવકો દ્વારા અનેક બ્લડ બેંક ચાલુ થઈ છે. આ ક્ષેત્રમાં આપણે સૌથી આગળ છીએ. આપણે તે દ્વારા પરિવર્તનના સારા અનુભવો કરી શક્યા છીએ. પ્રોફેશનલ બ્લડ ડોનેશનને બદલે સ્વૈચ્છિક રક્તાધાનના વિષયે સમાજમાં આપણે પ્રસ્થાપિત કરી શક્યા છીએ. આ વિષયમાં સમાજની માનસિકતા બદલવામાં આપણે મહુદાંશે સફળ રહ્યા છીએ.

પૂર્વાચલના રાજ્યોમાં વૈદ્યકીય સેવાના માધ્યમથી થયેલ પ્રયાસોના કારણે ઘણા પરિવર્તનનો અનુભવ આપણને થાય છે. આ ક્ષેત્રમાં રાજ્યનૈતિક તથા શિક્ષણ ક્ષેત્રના માધ્યમથી આપણા પ્રયાસોને ઘણું બળ મળતું રહ્યું. આ પરસ્પર પૂરક સંગઠનોના કારણે છેલ્લા ૫૦ વર્ષોમાં પૂર્વાચલનું ચિત્ર ઘણું જ અનુકૂળ થયું છે. નકસલ પ્રભાવિત ક્ષેત્રોમાં પણ કેટલાક અંશે આવા પરિવર્તન દેખાઈ રહ્યા છે.

આપણે વૈદ્યકીય સેવાક્ષેત્રમાં છેલ્લા ૫૦ વર્ષોમાં કેટલાક પ્રશંસનીય કાર્ય કરી શક્યા છીએ. ‘સેવા-સંસ્કાર-સંગઠન-પરિવર્તન’ સૂત્રનું અનેક સ્થાનો પર પ્રત્યક્ષ અનુભવ કરી શક્યા છે. પરંતુ આપણા સમાજની આવશ્યકતાઓ વિશે વિચાર કરીએ તો, આ પ્રયાસો પૂરતા નથી. હજુ ઘણું બધું કરવાનું છે, આથી જ સેવાક્ષેત્રનું મહત્વ સમજી હવે ઘણા કાર્યકર્તાઓને આમાં જોડાવાની આવશ્યકતા છે. પૂ. ડૉ હેઠેવારજીની જન્મ શતાબ્દી પછી આ વિષયમાં આપણે જરૂરી આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેનાથી પ્રેરણા લઈ, આપણે હજુ પણ જરૂરી આગળ વધીશું, આ વિશ્વાસ છે.

મુદ્રક પ્રકાશક : સેવા ભારતી ગુજરાત વર્તી, શ્રી ગિરીશભાઈ દિંમતલાલ પટેલે નવભારત પ્રિન્ટિંગ પ્રેસ, ૯, પુનાજી ઇન્ડસ્ટ્રીયલ એરોસ્ટેટ, શાન્દિલે મંદિર પાસે, ધોબીઘાટ કોસ રોડ, દૂર્ઘેશ્વર, અમદાવાદ-૩૮૦ ૦૦૪ ખાતે છપાતી સેવાભવન, ૭, જોલી પાર્ક સોસાયટી, શ્રેયસ કો. ઓ. સ્ટોરની બાજુમાં, અમદાવાદ-૩૮૦૦૨૨ ગુજરાતથી પ્રગત કર્યું.